


ISSN 0976 – 9609 V-Vidyanagar

વર્ષ: ૨૬ || અંક: ૬ || જૂન ૨૦૨૪ || સંખ્યા અંક: ૬૩૨

વ-વિદ્યાનગર

(Peer-Reviewed Magazine)



CHARUTAR VIDYA MANDAL

(Est: 1945)

Vallabh Vidyanagar-388120

www.vvidyanagar.ecvm.net

॥ શ્રદ્ધાંજલિ ॥



ચારુતર વિદ્યામંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ન્યુ વિદ્યાનગરના સ્થાપક સ્વ. ડૉ. સી. એલ. પટેલની પૂજ્યતિથિ નિમિત્તે
તા. ૨૭/૦૫/૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ન્યુ વલ્લબ વિદ્યાનગર ખાતે આવેલ મદ્દ્હીમાં
તેઓનું તૈલચિત્ર મુક્કવામાં આવેલ છે ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્ઞને સ્વ. ડૉ. સી. એલ. પટેલને
શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખશ્રી મનીષભાઈ પટેલ, ઈન્દ્રાજિત માનદ
મંત્રીશ્રી રમેશભાઈ તલાટી, સહમંત્રી શ્રી વિશાલ એચ. પટેલ તથા કોલેજના આચાર્યશ્રીઓ/વડાશ્રીઓ તથા ચારુતર
વિદ્યામંડળના કર્મચારી ગણ ઉપસ્થિત રવા હતા અને પૂ. ડૉ. સી. એલ. પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.





तंत्री
उर्वशि छाया
परामर्शन

नरेश वेद • राजेन्द्रसिंह जडेजा
भगीरथ भ्रह्मभट्ट • आर. पी. पटेल

संपादन-सहाय
विजय सुथार

प्रकाशक

डॉ. एस.ज्ञ.पटेल

मानद मंत्री, चारुतर विद्यामंडण

वक्ष्याल विद्यानगर-३८८ १२०

•

मुद्रक

सीबीओम प्रेस, वक्ष्याल विद्यानगर-३८८१२०

वि-विद्यानगर
चारुतर विद्यामंडण प्रकाशन

जून-२०२४
वर्ष : २६ अंक : ६
संग्रह अंक ६३२

ISSN 0976-9609-V Vidyanager

चारुतर विद्यामंडण
वक्ष्याल विद्यानगर-३८८ १२०
स्थापना वर्ष : १९४५



प्रमुख	उपप्रमुख
श्री प्रधास्वीनभाई बी. पटेल श्री मनीषभाई एस.पटेल	
अध्यक्ष	मानद मंत्री
श्री भीमभाई बी. पटेल	डॉ.एस.ज्ञ.पटेल


मानद सहमंत्रीओ	
श्री भेहुल डी. पटेल	
श्री रमेश सी. तलाठी	श्री विशाल एच.पटेल

वृत्ति अने प्रवृत्तिए विद्यानगरनी विभावनाने मूर्त करतुं विशाल ज्ञानसंकुल
प्राथमिक अने माध्यमिक कक्षाए गुजराती तथा अंग्रेजी माध्यमां शिक्षण सुविधाओ • उच्चतर माध्यमिक शिक्षणसंकुलना विज्ञान, सामान्य, गृहविज्ञान प्रवाह • उच्च शिक्षण क्षेत्रे विनयन, वाणिज्य, विज्ञान, गृहविज्ञान, यंत्रविज्ञान, ईजनेरी विज्ञान, औषध विज्ञान, ललितकलाओ चित्र, संगीत, नृत्य, शारीरिक शिक्षण, आयुर्विज्ञान, बायोटेक्नोलोजी, होटेल मेनेजमेन्ट, टुरिझम ट्रैवेलना अभ्यासक्षमोने आवरी लेती कोलेज आँक बिझनेस एन्ड ओडमिनिस्ट्रेशन, अंग्रेजी भाषाशिक्षण तथा प्रशिक्षण व्यवस्थानी कोलेज • अनुसन्नातक कक्षाए वाणिज्य अने व्यवस्थापन, विज्ञान, औषधविज्ञान, गृहविज्ञान, ईजनेरी, दर्दनशास्त्र, अंग्रेजी प्रशिक्षणाना अभ्यासक्षमो • विविध विद्याशाखाओमां व्यापक संशोधननी सुविधाओ • कला, विज्ञान अने मानवविद्याओना विभास्त्री भूमिका रची आपतां पुस्तको-सामग्रिक प्रकाशनो • विद्याकीय वातावरणने धर्कतुं राखती विविध व्याख्यानमाणाओ • सर्जठो, सारस्वतो, कम्भयारीओना सन्माननी उक्खण घरंपरा, २मतगमत क्षेत्रे राष्ट्रीय स्पृधाओनुं युवकोन्मुख आयोजन • प्राथमिकथी लઈ अनुसन्नातक कक्षानां विद्यार्थी भाईहलेनो भाई छात्रालयो, अध्यापक निवासो तेमજ आचार्य निवासोनी सुविधाओ • सतत विकासनी परंपरामां वक्ष्याल विद्यानगर उपरांत न्यू वक्ष्याल विद्यानगर टाइनशीपमां विविध अभ्यासक्षमोवाणी शिक्षणसंस्थाओनी स्थापना थती रही छे. • राज्यनी प्रथम महिला ईजनेरी कोलेज, सरटार पटेलना ज्वन अनो कार्य भाटे देशनी सर्वप्रथम संशोधन संस्था तेमज समग्र गुजरातां अंग्रेजी माध्यमनी स्नातक कक्षानी प्रकाशत्व अनो समूह माध्यमोनी कोलेज, गुजरातनी युवाहेढीने सनदी सेवाओमां प्रवेश आपवा माटेनी सीबीओम आइयेएस एकोडभी • कायदाशास्त्र अने न्यायशास्त्रानी अनोभी कोलेज • ईन्टरियर डीजाइन अने आईटेक्युरनी स्कूल उपरांत फाईन आटर्सनी डिग्री कोलेज.

अंकनी छूटक किंमत : ₹ १५/- रवानगी खर्च : ₹ १०/- वार्षिक लवाजम : ₹ १५०/-
विद्यार्थी लवाजम : ₹ १००/- आज्ञवन लवाजम : ₹ १५००/-

વદ્વભ વિદ્યાનગરના આધુસ્થાપકો પૈકી એક ભાઈકાંએ ઇ.સ. ૧૯૬૪માં આ વિદ્યાકેન્દ્ર ઉપરથી એક સામયિક પ્રકાશિત થાય જેમાં સહિત્ય અને શિક્ષણ વિષયક સંસ્કારલક્ષી સામગ્રી રજૂ થાય અને ઉચ્ચ અભ્યાસ અર્થે આવતી કિશોર-યુવાપેઢી એથી લાભાન્વિત થાય, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ એમાં સહીય રસ લેતા થાય એવી મનીષા પ્રગટ કરી હતી. ફિલ્મસ્ટ્રેપ ૧૬ નવેમ્બર ૧૯૬૪ના રોજ 'વદ્વભ વિદ્યાનગર' પાકિઝનો આરંભ થયો. પછીથી એ માસિક સ્વરૂપે 'વિદ્યાનગર' નામે પ્રગટ થતું રહ્યું. બિના નામે એનો ત્રીજો અવતાર થયો ત્યારથી પૂર્વ અધ્યક્ષ ડૉ. સી. એલ. પટેલની નિસબ્દત અને ઉદ્ઘારતાના ફિલ્મસ્ટ્રેપે તે નવપ્રદ્વારિત થયું, અને ઇ.સ. ૧૯૬૮થી નિયમિતપણે 'વિ-વિદ્યાનગર' એ નામથી પ્રકાશિત થતું રહ્યું છે.

વિ-વિદ્યાનગર
વિ-વિદ્યાનગર www.vvidyanagar.ecvm.net
 પર મૂક્વામાં આવે છે. દેશ-વિદેશના વાચકોને
 પ્રતિભાવ જણાવવા વિનંતી.



આ માસની વિચાર-કણ્ઠિકા

કેશવ તમને વીનવે સ્વામી, મંગલ કર મૂરતિ
 ધૂપ દીપ ને જળહળતી જ્યોતે, ઉતારીએ આરતી.
 ગરવા ! પાટે પધારો ગુણપતિ

- ॥ પ્રાથમ્ય ॥ જીવનરૌલી.....૩
- ઓસ. જી. પટેલ
- ॥ આપણો વૈભવ અને વારસો ॥૬
- પદ-વિભાગ : રવિસાહેબ, લીરલબાઈ
- ॥ નવાં કાચ્યો ॥૯
- નરેશ સોલંકી, અચિન ચેંડારાણા,
 પુષ્કરરાય જોશી, નિર્જરી મહેતા
- ॥ આપણો વૈભવ અને વારસો ॥
- ગદ-વિભાગ : ભારતીય સંસ્કૃતિના કવિ૮
- ઉમાંદર જોશી
- ॥ લઘુકથા-૧ ॥ શોધ.....૧૦
- મનસુખ સત્ત્વા
- ॥ લઘુકથા-૨ ॥ પીળાશ૧૦
- પ્રેમાભાઈ ઓસ. પટેલ
- ॥ વાર્તા ॥ ગરભડ.....૧૧
- મનીષા રાઠોડ
- ॥ વિદેશી વાસીની વતન વંદના ॥૧૬
- ॥ લલિત નિબંધ ॥ ઊડઊડ કરે એ પંખીઓ.....૧૮
- સિલાસ પટેલિયા
- ॥ સમીક્ષા લેખ ॥
- પન્નાલાલ કૃત વળામણા લઘુ નવલકથા૨૦
- પ્રવીણલભાઈ ભીખાભાઈ વજર
- ॥ સામાજિક ॥ ગો-સેવા પરમો ધર્મ:.....૨૪
- દર્શક કે. પરમાર
- ॥ શિક્ષણ ॥
- વિશ્વ કલ્યાણને માટે ભારતીય શિક્ષણ.....૨૬
- મુલાકુલ કાનિટકર અનુવાદ : મહેન્દ્ર નાઈ
- ॥ વિદ્યાવૃત્ત ॥૩૦
- ॥ આયુર્વેદ ॥ આધુનિક યુગમાં નિદ્રા.....૩૧
- આશિષ એમ. ભડાણીયા¹ રિટેશ ગુજરાથી²

॥ પ્રાથમ્ય ॥

જીવનશૈલી

સંકલન : અસ.જી.પટેલ

- જે કામ ન કરે તેણે ખાંચું પણ ન જોઈએ.
- તમારે એ પ્રકારે જીવનું જોઈએ, જેમાં તમારે માટે હિંસાની જરૂર ન રહે.
- શારીરિક શ્રમથી બૌદ્ધિક પ્રવૃત્તિ બંધ થતી નથી, પણ તેની ગુણવત્તા સુધરે છે અને તેને મહદું થાય છે.
- દરેક શારીરિક શ્રમ મનુષ્યને વધુ ઉમદા બનાવે છે. જો તમે તમારા સંતાનને કોઈક શારીરિક હુન્નર નથી શીખવતા તો તમે એને બીજાને લૂંગવાનું શીખવો છો.
- માંગાને જીવનની એક પ્રાકૃતિક અવસ્થા તરીકે જોવી જોઈએ.
- માંગાની લગભગ હંમેશાં વ્યક્તિની શારીરિક શક્તિનો નાશ કરે છે, તે વ્યક્તિની આત્માની શક્તિને મુક્ત કરે છે. જે વ્યક્તિ પોતાની ચેતનાને આધ્યાત્મિક ક્ષેત્રમાં કેન્દ્રિત કરે છે, તેની સારાઈને માંગાની ખતમ કરી શકતી નથી, ઊલટાની તેને વધારે છે.
- માંગાની ગભરણો નહીં, એટલે એમ ન વિચારણો કે માંગાની તમને તમારી નૈતિક જવાબદારીઓમાંથી મુક્ત કરે છે.
- સામાન્ય રીતે લોકો એમ વિચારે છે કે જ્યારે તમે તંદુરસ્ત હો ત્યારે જ ઈશ્વર અને માનવતાની સેવા કરવી શક્ય છે. આ સાચું નથી. ધારી વખત આનાથી ઊલંઘ હોય છે. ઈસુ જ્યારે કોસ પર પીડાતા હતા ત્યારે જ તેમણે ઈશ્વર અને સમગ્ર માનવતાની સેવા કરી, પરિણામે તેમણે તેમને મારનારાઓને પણ માફ કર્યા. દરેક વ્યક્તિ આમ

કરી શકે છે. ઈશ્વરની અને માનવજાતની સેવા કરવા માટે કઈ અવસ્થા સારી છે, તંદુરસ્ત કે માંગાની, તે તમે કહી શકો નહીં.

- તમારા સ્વાસ્થ્યની અવગાણના તમને અન્ય લોકોની સેવા કરતાં અટકાવી શકે, અને તમારા શરીર તથા સ્વાસ્થ્ય પર વધારે પડતું ધ્યાન પણ એવાં જ પરિણામ આપી શકે. વચ્ચેનો રાહ શોધવા માટે, તમારે તમારા શરીરની એટલી જ કાળજી રાખવી જોઈએ. આમ કરવાથી તમને અન્યોની સેવા કરવામાં મહદું થાય, જે તેમની સેવા કરતાં તમને અટકાવે નહીં.
- જો આપણે મૃત્યુ પછીના જીવનના અસ્તિત્વ ઉપર ચિંતન-મનન કરીએ, તો માંગાની આપણને એક જીવનથી બીજા જીવન તરફથી ગતિની નજીક લઈ જતી હોય તેમ લાગશે - એવો બદલાવ જે અનિયાતીય કરતાં ઈચ્છાનીય વધુ છે. આવી પીડા વખતે આપણે આપણને શું થશો તે સમજને ખુદને સમજાવી શકીએ છીએ, તેથી આપણા હવે પછીના અસ્તિત્વની નવી અવસ્થા માટે તૈયાર થઈ શકીએ છીએ.
- શ્રેષ્ઠ ખોરાક એ છે કે જે અન્ન તમે અથવા તમારાં સંતાનો જાતે બનાવે.
- કેટલાંક દુષ્કૃત્યો અન્યો સાથે આચરો છો અને કેટલાંક દુષ્કૃત્યો તમે ખુદની સાથે આચરો છો. જ્યારે તમે બીજાઓની અંદર રહેલ પરમાત્માના અંશને આદર નથી આપતા ત્યારે તમે અન્યો સાથે કુકર્મ કરો છો. તમે તમારી સાથે કુકર્મો કરો છો તેમાંનું એક ખાઉધરાપણું છે. જે વ્યક્તિ વધારે પડતું ખાય છે, તે આળસનો સામનો કરી શકતી નથી. એક આળસુ વ્યક્તિ જાતીય સ્વચ્છાંદ્તા સાથે લડી શકતી નથી. બધા જ આધ્યાત્મિક બોધની શરૂઆત નિયંત્રણોથી થાય છે. ખાવાપીવા પરના અંકુરણોથી થાય છે.

- ખાઉધરાપણાને ઘણા લોકો પાપ નથી માનતા, કરણ કે દેખીતી રીતે તે કશું નુકસાન ઉપજાવતું નથી. પરંતુ કેટલાંક પાપ એવાં છે કે જે મનુષ્યના ગૌરવને ખતમ કરી નાંભે છે અને ખાઉધરાપણું એક આવું જ પાપ છે.
- જ્યારે તમે વધારે પડતું ખાઓ છો ત્યારે તમારું મોહું જુઓ - તેના દ્વારા તમારા શરીરમાં માંહગી પ્રવેશી રહી છે. એવી રીતે વર્તો કે જ્યારે તમે બોજન સમાપ્ત કરો ત્યારે તમે હજુ થોડું ખાઈ શકવાની ભૂખ ઘરાબતા હો.
- મનુષ્યો જો પોતાને બ્રાન્ડી, શરાબ, તમાકુ અને ડ્રાઝથી ઝેર આપવાનું બંધ કરે તો મનુષ્ય જીવનમાં કેટલા અદ્ભુત ફેરફારો લાવી શકે તેની કલ્પના કરવી મુક્ખેલ છે. ઘણા લોકો કહે છે, “તમે શરાબ કે સિગરેટ પીવો તે મહત્વનું નથી.” જો તે મહત્વનું નથી અને તમે જાણો છો કે તેનાથી તમે ખુફ્ને નુકસાન કરો છો, અને તમારા ઉદાહરણથી અન્યોને પણ, તો શા માટે તે બંધ નથી કરી દેતા ?
- લોકો આજે મૂર્ખાની જેમ એમ માનવાનો પ્રયત્ન કરે છે કે દુનિયાની બધી અક્ષલહીનતા અને ફૂરતા-ગાળ્યાગાળ્યાંનો વૈબવ, કેટલાખની મોટી ગરીબી, હિંસા અને ચુદ્રો-તેમના જીવનની બહાર ઘટે છે અને તેમની તેમ જ તેમની જીવનશૈલી સાથે દખલગીરી કે ચંચુપાત કરતાં નથી.
- કોઈ વ્યક્તિ તેના જીવનના હેતુને માંહગીમાં કે કોઈપણ અવસ્થામાં એકસરખી રીતે પરિપૂર્ણ કરી શકે છે.
- આપણે આપણી જિંદગીને આરામદાયક બનાવવા જે બાબતો કરતાં હોઈએ છીએ તે મને એવા શાહમૃગની યાદ અપાવે છે, જે તેના શત્રુઓને જોઈ ન શકે તે માટે તેનું મસ્તક છુપાવી દે છે. આપણે શાહમૃગ કરતાં પણ ખરાબ રીતે વર્તીએ છીએ. કોઈ અસ્પષ્ટ અને શંકાસ્પદ ભવિષ્યને મેળવવા માટે આપણો સ્પષ્ટપણે અર્થપૂર્ણ વર્તમાન સમયના આપણા જીવનને ચોક્કસપણે ખતમ કરી દઈએ છીએ.
- વ્યક્તિએ જે કરવું છે તે કરતાં તેને કોઈ માંહગી અટકાવી શકતી નથી. જો તમે કશું કામ ન કરી શકો, તો લોકોને તમારો પ્રેમ આપો.
- કોઈ જમીનને ખેડવાના ખેડતના શ્રમ કરતાં વધુ આનંદદાયક બીજું કશું નથી.
- જમીન પર કામ કરવું અને તમારી રોટી તમારી મેળો પેઢા કરવી એ બધા લોકો માટે આવશ્યક કામ નથી, પરંતુ માનવતા માટે આનાથી વધુ મહત્વનું કોઈ પ્રકારનું કામ નથી અને બીજાં કોઈ પ્રકારનાં કામ આનાથી વધુ સ્વતંત્રતા અને સારપ આપતાં નથી.
- ઘણી વાર જ્યારે હું જીવલેણ રોગ ઘરાબતાં લોકો સાથે કામ કરું છું, ત્યારે હું એ શીખ્યો છું કે દર્દની નજીક આવતાં મૃત્યુને તેનાથી સંતાડવું નહીં; તેનાથી વિશુદ્ધ, તેને તેની દિવ્ય, આધ્યાત્મિક પ્રકૃતિ વિશે જણાવવું - જે એની અંદર વિકસે છે અને જેનો મૃત્યુ દ્વારા નાશ કરી શકતો નથી એ વધુ મહત્વની વાત છે.
- તમારા શરીરનો, તમારા પાત્રનો આજે જ ઉપયોગ કરો; આવતીકાલે તે તૂટી જઈ શકે છે.
- ચુદ્ધ દરમ્યાન વધારાની કુમક તરીકે મોકલાયેતા સૈનિકો તેમના આશ્રયસ્થાને નવરા ઊભા હોય ત્યારે, માથે તોળાઈ રહેલ જોખમમાંથી મન બીજે વાળવા તેઓ કોઈપણ પ્રવૃત્તિમાં ખુફ્ને પરોવે છે. મને એમ લાગે છે કે જે લોકો પોતાને જીવનથી બચાવવા માંગતા હોય તેઓ આ સૈનિકો જેવું જ વર્તન કરે છે. કેટલાક પોતાને આડબરોમાં, કેટલાક પતા રમીને, બીજા રાજકારણ, કાયદાઓ, સ્થીઓ, જુગાર, ધોડાઓ, શિકાર, શરાબ કે

રાજક્ષણનાં કામોમાં સંડોવીને ખુદનું ચિત્ત બીજે વાળે છે.

- તમારું શરીર શુભ અને અનિષ્ટથી ભરપૂર એવું એક શહેર છે; તમે આ શહેરના રાજી છો અને તમારી બુદ્ધિ તમારી શ્રેષ્ઠ સલાહકાર છે.
- જેઓ પોતાની જતને ધાર્મિક ગાણાવે છે તેમના કરતાં જેઓ પોતાનો ખોરાક પોતાની મેળે પેઢા કરે છે, તેઓ વધુ આદરણીય છે.
- લોકો મોજશોખની પાછળ વારંવાર એટલા માટે દોડ્યા કરે છે કે જે પણ નવું મનોરંજન તેમને આકર્ષણું હોય છે તેના ખોખલાપણા કરતાં તેઓ તેમના જીવનના ખોખલાપણાને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય છે.
- જ્યારે કોઈ વ્યક્તિ કામ કરવું શક્ય કરે છે, ત્યારે અગર કામ બિલકુલ અયોધ્ય, આશંકા કે સીધુંસાદું હોય, તો પણ મનુષ્યનો આત્મા શાંત થઈ જાય છે. જેવું વ્યક્તિ કામ કરવાનું શક્ય કરે છે કે બધા રાક્ષસો તેને છોડી દે છે અને તેની પાસે ફરકી શકતા નથી. વ્યક્તિ છેવટે માનવ બને છે.
- શારીરિક શ્રમ, તમારા શરીર માટે શારીરિક વ્યાયામ એ જીવન માટે આવશ્યક શરત છે. ભલે પોતાના માટે કામ કરવા મનુષ્ય બીજાઓને ફરજ પાડે, પણ તે પોતે પોતાનાં શારીરિક કાર્યો કરવામાંથી ખુદને મુક્ત ન કરી શકે. જો કોઈ મનુષ્ય સારી અને જરૂરી બાબતો માટે કામ નહીં કરે, તો તે બિનજરૂરી અને ફાલતું બાબતો પાછળ સમય બરબાદ કરશે.
- કામ આવશ્યક છે. જો તમે તમારા મિજાજ અને અભિગમને સારા રાખવા ઈચ્છાતા હો, તો થાકી જાઓ ત્યાં સુધી કામ કરો, પણ વધારે પડતું નહીં. તમે થાકીને ફસડાઈ પડો ત્યાં સુધી નહીં. એક સરસ આધ્યાત્મિક અવસ્થા વધારે પડતા
- કામથી અને આળસથી પણ નાચ થઈ શકે છે.
- કામ-કાર્ય કરવાની પ્રક્રિયા જ આપણા માટે મહત્વની છે. તેના વળતરનું મહત્વ ગૌણ હોયનું જોઈએ. જો તમારા માટે વળતર વધુ મહત્વનું હોય અને તેની સરખામણીમાં કામ પોતે ઓછાં મહત્વનું હોય, તો તમે વળતરના અને તેના સર્જક શેતાનના ગુલામ છો - અને આ શેતાન બધા અસુરોમાંનો સૌથી નીચ અને અધમ છે.
- પોતાના સનાયુઓને કસરત આપ્યા વિના મનુષ્ય કે પ્રાણી, કોઈ જીવી શક્તિનું નથી. આ કસરત તમને આનંદ અને સંતોષ આપે તે માટે સાંચ શારીરિક કામ કરો. બીજા લોકોની સેવા કરવાનો પણ આ ઉત્તમ રસ્તો છે.
- તમારે કોઈ પણ કામથી શરમિદા ન થવું જોઈએ, ભલે તે સૌથી નિમ્ન કે ગંદું હોય, પરંતુ તમારે સૌથી ગંદી નૈતિક અવસ્થાથી જ શરમાવું જોઈએ, જે તમારી આળસ છે અને જે બીજા લોકોની મહેનત-મજૂરીના આધારે ટકે છે.
- ખુશી માટે કામ કરવું એ આવશ્યક પૂર્વશરત છે, પહેલું, મનગમતનું અને મુક્ત કાર્ય; બીજું, શારીરિક શ્રમ જે તમારા જઈરામ્ને જગાડે અને પાછળથી તમને ગાડ અને શાંત નિદ્રા અર્પે.
- નિરંતર આળસનો સમાવેશ નર્કની યાતનાઓમાં થવો જોઈએ, પણ ખરેખર, તેનાથી વિરુદ્ધ તે સ્વર્ગના આનંદમાંનો એક ગણાય છે.

માનદ્દ મંત્રી, ચારુતર વિદ્યામંડળ
વલ્લભ વિદ્યાનગર, ફોન (૦૨૬૬૨) ૨૩૮૪૦૦
Email:sgpatel1948@gmail.com

॥ વૈભવ-વારસો પદ્ય વિભાગ ॥

સમરું, સાંજ સવેરા

રવિ સાહેબ

સમરું, સાંજ સવેરા એવા ગુણના પતિ,
સૂંદ્રાળા રે સૂંદ્રાળા રે, જી.
માતા ભાડુંજે જેની પાશવતી હે સ્વામી,
પિતા શંકર દેવા એવા... સમરું
ધી રે સિંધુરની રે સેવા ચઢે એ સ્વામી,
ગણે કૂલદાંની માળા એવા... સમરું
મધૂર મુગાટ શિર છત્ર બિરાજે સ્વામી,
કનુમેં કુંડળવાળા એવા... સમરું
અઢારે વરણના વિઘન હરો છો સ્વામી,
ધર્મની બાંધેલ ધર્મશાળા એવા... સમરું
કહે રવિસાહેબ ભાડા પ્રતાપે સ્વામી,
ખોલેલ ભરમનાં તાળાં એવા
સમરું, સાંજ સવેરા ગુણના પતિ...

જમા જગરણું કુંભ થપાણો

જમા જગરણનો કુંભ થપાણો, મળિયાં જતિ ને સતી
ગરવા ! પાટે પદ્ધારો ગુણપતિ.
પાટે પદ્ધારો ગુણપતિ સંગમા, સિદ્ધ બુદ્ધ નારી સતી
ગરવા ! પાટે પદ્ધારો ગુણપતિ.
નિજિયા પંથીએ મંડપ રોપાચા, ધજ ધરમની ફરકતી;
ગત્ય ગંગાને આરાધે દાતા,
જયાં નર નારી એક ભતિ. - ગરવા
વેદ ભાણતા બ્રહ્માજી આવ્યા, આવ્યા લખમી પતિ;
કેલાસેથી ભોળાનાથ પદ્ધાર્યા, સંગમા મા પાર્વતી. - ગરવા
નવ નાથને સિદ્ધ ચોરાશી, આવ્યા છે ગોરખ જતિ
પોકરણ ગઠથી પીર રામદે પદ્ધાર્યા,
બાર બીજના પતિ. - ગરવા
તેવીસ કોટિ દેવતા આવ્યા ને, આવ્યા હનુમોજતિ
બાવન વીર ને ચોંસદ જોગણી,
આવ્યાં મા સરસ્વતી. - ગરવા
કેશવ તમને વીનવે સ્વામી, મંગલ કર મૂરતિ
ધૂપ દીપ ને ઝળહળતી જ્યોતે, ઉતારીએ આરતી.
ગરવા ! પાટે પદ્ધારો ગુણપતિ

ગણપતિ આવે જૂલતા

લીરલભાઈ

દેખ્યા રે મેવાડી રામા, નીરખ્યા રે હાં,
શ્રી ગણપતિ આવે જૂલતાં હો રે હો જીજ
હસતા ને રમતા આવે, શ્રી ગણપતિ વીરા,
માન રે સરોવર સો યે જીલતા - ગણપતિ
પેરણ પીતાંબર, ઓઢણ આછાં ચીર વીરા,
શાલ રે દુશાલા સો યે ઓઢના - ગણપતિ
પેચ રે સમાણી બાંધે રે પદ્ધિયાં વીરા,
દરપણાં મુખા સો યે દેખતા - ગણપતિ
કેં રે કંટાર ને ગવે ઝેઢમાલા વીરા,
કાનું મેં કુંડળ સો યે પેરતા - ગણપતિ
ઊંચી ઊંચી મેડી, અજબ ભરુંભા વીરા,
અધર સિંહાસન સો યે બેસતા - ગણપતિ

પરથમ પેલાં

પરથમ પેલાં એની થાપના થાપી રે,
એકલદંતો મનાવા આવે રે
પાંચ મળી એને પાટે પદ્ધરાવે ઈ તો,
રિદ્ધિ સિદ્ધિ લાલ લાવે રે..
સાંજ સવેરા ભજુંચે ભાવે,
ગુણના પતિ જૂલતા ગતમાં આવે
સીતા સાવિત્રી ઉમિયા ગાયત્રી,
ઈતો મુખમાં લઈ મનાવે રે
કરોડ તેવીશે એની જ્ઞાનાએ આવે,
બ્રહ્મા વિષણુ મહેશ્વર આવે રે;
સુંદ્રાળા સ્વામીને અંદર પરખો તો,
નિરખ્યા નેણું માંય આવે રે...
નર-નારી એની નમાણું કરે, સિંહરની સેવા ચઢાવે રે;
પાંચ લાડુડા પાય ધરે તો, સૂંધ સફેદ રંગ લાવે રે..
ચરણ ધોઈ એનાં ચરણામૃત લેવે,
ગત ગંગામાં પાવળ પાવે રે;
ધૂપ ધ્યાને એની આરતી ઉતારે તો;
તેજમાં તેજ મળી જાવે રે...
ગુરુ મંગળગર પૂરા મળિયા, સત સ્વરૂપ દરશાવે રે;
દાસ કાળુ કરે મૂળ મહેલ માથે,
ઈ તો ગુણપતિ નજરે આવે રે...
પરથમ પેલાં એની થાપના થાપી રે;
એકલદંતો મનાવા આવે રે..

॥ નવાં કાવ્યો ॥

થોડો ઓળખાઈ શકું

નરેશ સોલંકી

થોડોક ઓળખાઈ શકું આવ આ તરફ
હું પણ જરાક ગાઈ શકું આવ આ તરફ
હું પણ નજરની બહાર પછી નહીં રહું કદી
પાંપણમાં હું છુપાઈ શકું આવ આ તરફ
બે ચાર ગુણગાન કર્યા મેંય યાદગાર
ક્યારેય ના ભુલાઈ શકું આવ આ તરફ
વાડામાં બંધ રાખવું માણસની ટેવ છે
એમાં ન ગોઠવાઈ શકું આવ આ તરફ
તારા વિચાર એ જ તો મારા વિચાર છે
ભોળો છું ભોળવાઈ શકું આવ આ તરફ

મહારી પોલીસ હેડકવાર્ટર, બ્લોક નં.સી-૧
કવા.નં.૦૬, નાના મોવા રોડ,
રાજકોટ (મો) ૮૩૨૦૬૪૮૭૦૦

ગઝલ

અશ્વિન ચંદ્રાશા

મારો સહારો ત્યારે લાંબી કથા મળે છે!
ઉભા ન થઈ શકતું એવાયે ધા મળે છે!
ફળતી નથી કદી પણ, આશા પરાયી કો' દી,
આખ્યો અમે સહારો, એની સજ મળે છે!
કોઈને પરાગે રોકી, કહેજો તમારી તકલીફ-
'હા' કણમાં મળે, ને અંતરમાં 'ના' મળે છે!
બદધી જ વાતે સીધું, વાંકું એકાદ વાતે-
જેનાં નસીબ સીધાં, એને જ મા મળે છે!
ગાંજો, ચરસ કે દારુ, આપણને એનો ખપ નહીં!
આપણને જોઈએ ત્યારે, અડધીયે ચા મળે છે!

એ-૨૨૮, સૌરભ પાર્ક, સમતા ફ્લેટ પાછળ,
સુભાનપુરા, વડોદરા-૩૬૦૦૨૩, (મો) ૯૬૦૧૨૫૭૫૪૩

તીર સધળાં ધૂઢી નિયાં

પુજુરરાય જોથી

તીર સધળાં ધૂઢી નિયાં ને
ભાથામાં છે થોથાં,
સમજણા કેરો છાટો ના'વ્યો,
હજુ ખાઉં છું ગોથાં.

કેવાં કેવાં કારસ કીધાં !
તોયે ન આવ્યો પાર,
ડગલે-પગલે ઠોકર ખાતો,
છ્ટાં ક્યાં માને હાર !
કંચન શી મોલાત કથીર થઈ,
ભાયે આવ્યાં ભોથા...

સપનાઓનો મહેલ સજાવી,
કીધાં રંગ ને રાગ,
જેવો સૂરજ ઉંઘો તેવી,
લાગી ભીખડા આગ,
ખાક થઈને ખ્વાબો ઉડિ,
દેતાં દખના દોથા.

Pushkaray Joshi
479, Gujarat Housing board,
Kankot patiya, Kalavad road,
Rajkot -360005, (M) 9925165164



(અનુસંધાન પાન નં. ૯ ઉપર)

॥ વૈભવ-વારસો ગદ્ય વિભાગ ॥

ભારતીય સંસ્કૃતિના કવિ

ઉમાશંકર જોશી

કાલિદાસ ભારતના રાષ્ટ્રકવિ છે. ભારત ખેતીપ્રધાન દેશ ભારતની મધ્યમધતી સંસ્કૃતિ પાણીને ટીપે ટીપે મોતી વેરતા, દરેક ચાસમાં મોતી વેરતા મેધના આધારે છે. કવિની કલ્પનાએ એ મેધને સદેશવાહક તરીકે પસંદ કર્યો તે ઘડીએ સહેજ એ રાષ્ટ્રકવિના બિરુદ્ધને પાત્ર થયા.

કવિએ 'મેધદૂત'માં મધ્ય ભારતથી હિમાલય-ખોળે અલકા સુધીનાં નદીઓ, પર્વતો, નગરો, તીર્થો વર્ણાવ્યાં. 'રધુવંશ'માં સીતાને રામ પુષ્પક વિમાનમાંથી લંકાથી ગોદાવરી સુધીના પ્રદેશો, ઉપરાંત વિવેણીસંગમ આદિ બતાવે છે. હિમાલયને તો 'કુમારસંભવ'ના આરંભમાં મન મૂકીને ગાઈ લીધો હતો. છતાં રધુનો દ્વિષિજ્ય વર્ણવતાં તેનાં દળોનું કાશીરથી હિમાલયના ઉત્તરના પ્રદેશોમાં થઈ લૌહિત્યા (બ્રહ્મપુરા)નદી ઓળંગી પ્રાગ્જ્યોતિષ (આસામ)માં પ્રવેશતાં વર્ણવી ભારતના ઉત્તર સીમાડાઓ પર એમની કવિતા ધૂમી વળે છે. ભારતની ભૌતિક રચનાનાં દસવીસ સૈકમાં સહેજે ન બદલાય એવાં ચિરસ્થાયી સ્વર્ણપોનાં સૌંદર્યને કવિપ્રતિબા શબ્દમાં જીલે છે. એ જ રીતે દક્ષિણાં સમુદ્રતટે તાંખૂલ, નારિયેલ, મરી, એલચી, મૌકિક, ખજૂર આદિ, પણ્ણિમ તરફ દ્રાક્ષ, કાશીર તરફ કેસર, અખરોટ, હિમગિરિમાં કસ્તરી, ભૂર્જપત્ર અને આસામમાં કૃષ્ણાગુરુ આદિ નીપળે પણ પ્રસંગવશાત્ત કવિ ઉલ્લેખે છે.

ભારતના ખૂણેખૂણાના ભાગોનો ધારુખનું એમને જાણે જાતઅનુભવ ન હોય, એવું એમનાં વર્ણનોની સુરેખતાથી સમજાય છે ! કાલિદાસ અંધુ ભારત પ્રવાસી છે. ભારતની પ્રકૃતિલીલાનું સૌંદર્ય એમણે આકંઠ પીધું છે. અને એથીયે વિશેષ તો

અત્યંત ભાતીગળ એવી ભારતીય સંસ્કૃતિનું સમુદ્દ્ર ભાવે એમણે અભિલાઈપૂર્વક આકલન કર્યું છે અને આ દેશમાં ખીલેતા માનવસંસ્કૃતિના વિશેષ સ્વરૂપને એનાં સંપૂર્ણ લાભાભ્ય સાથે જગત આગળ શબ્દકારે હંમેશા માટે પ્રસ્તુત કર્યું છે.

કાલિદાસ મેધની કે વિમાનની ઊંચાઈએથી ભારતદર્શન કરે છે. કેવળ ભૂભાગો કે પેદારો જોતા નથી, સમાજે કયાં મૂલ્યોના આધારે જીવે છે તે એ જુએ છે. કાલિદાસ ભારતીય સંસ્કૃતિના કવિ છે.

આપણાં બે રાષ્ટ્રીય મહાકાવ્યો 'રામાયણ' અને 'મહાભારત'. 'રામાયણ'માં વાલ્મિકીએ કુટુંબ-જીવનના સંબંધોનું પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-ભાઈ આદિના સંબંધોનું-વ્યાકરણ સમજાવ્યું છે. 'મહાભારત'ના કેન્દ્રમાં વ્યાસ ધર્મને મુક્કે છે; અર્થ અને કામની સાધના પણ ધર્મ દ્વારા જ થઈ શકે, જ્યાં ધર્મ ત્યાં જ્ય - એમ એ ગાઈ-બજાવીને ઠસાવે છે. કુટુંબ અને રાજ્ય બંને સંસ્થાઓ મનુષ્ય સમાજ માટે મહત્વની છે. કુટુંબ વિના સંવર્ધન નથી. રાજ્ય વિના સંરક્ષણ નથી.

બે ઋષિકવિઓની પછી આવતા કાલિદાસ રસના, રસરાજ શૃંગારના કવિ છે, પણ તે એ બંનેને પગલે ચાલતા દેખાશે. શ્વીપુરુષ-પતિપત્ની વચ્ચેના પ્રેમનું ગાન એમને શાવે છે. દેહકર્ષણાનું - કામનું સંબલ એ પૂરું સમજે છે, પણ પ્રેમીઓને એમને જે કહેવું છે તે તો એ કે તપસ્યા લાવો. રસ લઈ જાઓ. વળી આ કવિ દંપતીની વાતમાં જ પુરાઈ રહેવામાં રાજુ નથી. સંવાદી પ્રેમવાળા દંપતીની સંતતિ ઉપર હંમેશાં એમની નજર મંડાઈ છે. અને એ બાળક પણ અસુરોના સૈન્ય સામે વિજ્ય માટે સેનાધિપતિપદ લઈ શકે એવો શિવ પાર્વતીજ્ઞાયો કુમાર હોવો જોઈએ. ભરતભૂમિને પોતાના નામથી અંકિત કરે એવો દુષ્યન્ત-શકુન્તલાસુત ભરત હોવો જોઈએ, દિતીપ-સુદક્ષિણાપુત્ર દાનવીર પ્રતાપી રાજ્યાં રધુ જેવો હોવો જોઈએ. આમ, કાલિદાસ પ્રેમના-શૃંગારના કવિ છે, પણ

પ્રેમની વાત કરવા માડે છે ને સમાજની સ્વસ્થ ચાલનાની - કુટુંબ અને રાજ્યની - વાતમાં એમની ચેતના ઓતપ્રોત થયા વગર રહી શકતા નથી. ઊંચા કવિ પાસે જ ઋષિકર્મની અપેક્ષા રહે તે કાલિદાસે બજાવ્યું છે. એથીસ્તો વાલ્મિકી અને વ્યાસની પછી કાલિદાસના નામનું સ્મરણ થાય છે.

પ્રકૃતિ સાથે સંબાધિતાથી જીવવું મનુષ્યો જ નહીં પણ પણુંચો, પક્ષીઓ, વૃક્ષો, લતાઓ સૌ સાથે આત્મીયતાથી જીવવું - સર્વમાં એકતા અનુભવવી એ મંત્ર કાલિદાસની કાવ્યસૂચિમાં ગુંજે છે. કવિએ પ્રકૃતિ અને માનવના મેળભર્યા જીવનનો મહિમા એના સૌંદર્યનો બોધ કરવા દ્વારા ઠસાવ્યો છે. આજે

પર્યાવરણ-શાસ્ત્ર (ઇકોલોજી)ના પ્રશ્નોની જગૃતિ વધતી જાય છે. ત્યારે કાલિદાસની વાત કેટલી સુસંગત છે તે સમજાતું આવે છે.

કાલિદાસની કલ્પના સ્વર્ગ, હિમાલયનો ઉદ્ઘર્બલોક અને ભૂતલ-બધે ફરી વળે છે, પણ પૃથ્વીના પક્ષપાતી છે. શકુન્તલા તારું મહિયર સર્વમાં, પણ સાસરું તો પૃથ્વીમાં, સ્વર્ગ તો ભોગભૂમિ છે, પૃથ્વી છે કર્મભૂમિ. કાલિદાસ પૃથ્વી ઉપરના માનવજીવનની આશ્રૂરમયતા પીતાં અને ગાતાં ધરાતા નથી.

(કાલિદાસ પુર્સ્તિકા : ૧૯૪૭)

‘અરધી સહીની વાચનયાત્રા’માંથી ટુંકાવીને સાભાર

॥ નવાં કાવ્યો ॥

તર્જની-અંગુઠા સંવાદ

નિર્જરી મહેતા

જુગતબંદ્દીનો સંસાર

તર્જની અને અંગુઠાનો

રસળતો કારોભાર

કલમનો!

બંનેઉચે

અક્ષર લહાણની

માણતાં ઉજાણી

વિતાવી સહીઓ!

ને હવે.....

રાવ કરે તર્જની!

“આમ શીદ થે ઓ છુટ્ટો

લ્યા અંગુઠિયા!!!!

મૂકી મને એકલી!

કેટકેટલી વિતે છ મને_

મારાં ટેરવાં ને

આ અક્ષરંની

સિંગલ મધર થાતાં!”

ઢેંગાભાઈને તો શું

દઈ દીધો જવાબ

વળતો!

“જરે મારી સ્વયંસિદ્ધા!

ટાઈપિંગની ટકાટકીની

આ મહોલાત

છે તારી એકલીની અસ્ક્યામત!

એક વેળાનો ડેંગો-ડેંગો ને

ટેબે-હડ્દોલે ચઢતો

હું અંગુઠડો

હવે લોકની હોંશને હિંડોળે....

મહાલુ થનગન થાતો!

શીદને જલે છે

ઓ મારી BFFE*

તર્જની!”



Best Friend For Ever (BFFE)

Email :nymjh@gmail.com

॥ લઘુક્રથા-૧ ॥

શોધ

મનસુખ સલા

શબ્દો જોડણીકોશમાંથી નીકળીને સરસ્વતી-દેવીને મળવા જવા નીકળ્યા. પાંચેક લાખની મેહની હતી. સરસ્વતીદેવીના દર્શનની હોંશમાં બધા શબ્દો યાત્રામાં જોડાયા હતા. પરંતુ પછી અંદરો-અંદરની વાતમાં જાણ્યું કે ‘આગેવાન શબ્દો તો ખાસ માગણી માટે સરસ્વતી દેવીને મળવા નીકળ્યા છે.’ ધીરે ધીરે શબ્દો અટકતા ગયા. સંખ્યા ઘટતી ગઈ. છેષે કેવળ દસ શબ્દો રહ્યા. સત્ય, પ્રેમ, અહિંસા, સંવેદના, વફાદારી, વચનપાલન, ન્યાય, કર્તવ્ય, મૈત્રી અને સેવા. હવે મેહની નહેતી. બાકી રહેલા દસેય શબ્દોએ પોતાની યાત્રા ચાલુ રાખી.

લાંબી યાત્રા પછી શબ્દો બ્રહ્મલોકમાં સરસ્વતીદેવીના સ્થાનમાં પહોંચ્યા. જઈને પ્રણામ કરીને હાથ જોડીને ઉભા રહ્યા. પ્રસંગ મુખે સરસ્વતી-દેવીએ આવકાર આપ્યો. આવવાનો હેતુ પૂર્ણો. સૌ

॥ લઘુક્રથા-૨ ॥

પીળાશ

પ્રેમાભાઈ એસ. પટેલ

જો બુન, ભાણિયા ઓથે પડતર ખેતર જેવી જિંદગી ખેયવી... કાઠી. હજુ તો તેને પચ્ચી થયાં છે. વિચારજે. મોટા મફતભાઈના બોલ ચિત્તના પડે વાસ્તવાર ઉઘડ્યા કરતા. એમના ગયા પછી તો મફતભાઈએ ઓછાવતી કરી ટ્રેક્ટર વેચાવી દીધું. જમીન ઉધડ પર વાવવા અપાવી. વાડોય ખાલીખણ !

બે દિવસ કેડ આમતેમ ઉદ્દી ચબરખીની જેમ નજીર વાડામાં ગઈ.. તો ટ્રેક્ટર.. થયું. કાકાનું હશે, પણ એ તો લાલ છે, આ તો લીલા.. પૂર્ણપરછ કરું તે પહેલાં પાડોશી મહેશલૈએ ફોડ પાડ્યો. એમના

વતી સત્યે કહ્યું, ‘હે માતા, અમે અમારો ખરો અર્થે ગુમાવી બેઠા છીએ. માણસો અમારો ભળતા અર્થમાં ઉપયોગ કરે છે. અમને અમારો ખરો અર્થ પાછો મળે એવી આપ કૃપા કરો.’ સરસ્વતીદેવીએ દસેય શબ્દો ઉપર આંખ ફેરવીને પૂર્ણું, ‘તમારો અર્થ ગુમાવી રહ્યા હતા ત્યારે તમે જગત કેમ ન રહ્યા ?’ સૌ વતી અહિંસાએ કહ્યું, અમે, માણસોને ધાણા વાર્યા, પણ માણસોએ અમારું સાંભળ્યું નહિ.’ થોડીવાર મૌન રહી સરસ્વતીદેવી બોલ્યા, ‘તમને સાચા અર્થમાં ધારણ કરનાર અને પ્રયોગ કરનાર માણસો મળશો ત્યારે તમારો સાચો અર્થ પાછો મળશો.’

રાજ થઈ, સરસ્વતીદેવીને વંદન કરી શબ્દો પૂર્ણી ઉપર પાછા આવ્યા. પોતાને ખરો અર્થ આપનાર મનુષ્યની શોધ કરવા તેમણે યાત્રા શરૂ કરી.

હજુ સુધી શબ્દોની આ શોધ ચાલુ છે.

સી-૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટ,
દેવાશિષ પાર્ક સામે, જજુસ બંગલો વિસ્તાર,
અમદાવાદ-૩૮૦૦૧૫, (મો) ૯૮૨૪૦૪૨૪૫૩,
Email:mansukhsalla@gmail.com

સાળાનું છે, આ તો વાડો ખાલી જોયો તે મૂકાયું.
કાલ જવાનું... ભાભી.. જાણો કોઈક ગોઢો માર્યો.. તે છેક..

જો મીના, ખાલી હેખે એટલે સૌ મૂકે,
કેટલાને ના કહેવું ! વાડો હોય કે ચોપાડ હોય કે ...
અટકીને સાવ ધીમા અવાજે બબડ્યો કે બૈરું જ ના
હોય.. ! પછી મર્મમાં હુસેતા. પતિના એ શબ્દો
ચિત્તભૂમિ પર ઉઝ્યા, આપો દિવસ લહેરતા રહ્યા..

સાંજના મેં તો મફાનીને કહેવડાયું તે અહીં
આંટો મારી જજો..., આવો તો રાત રોકાવાય તેમ
આવજો તે વાતોય થાય.

મન તો પાનખરના પાંદડા જેવું પીળું પડવા
માડેલું.. જાણો પીકીની પીળાશ.

મુ.પો. ખેરોલ, ડે.મહાદેવ વાસ, તા. તલોદ,
પીન-૩૮૩૨૧૫ બ્લિ. સાબરકાંડા (મો) ૯૪૨૬૩૬૫૮૦૨

॥ વર્ત્તો ॥

ગરબડ

મનીખા રાહોડ

ઓગતી સવારનો કૂણો તડકે, તાજા ખરી પડેલા પારિજ્ઞતાનાં ફૂલોની મધુર ફેરભ, સહેજ ઉંચાઈ પર ઊગેલો સફેદ ચંપો અને લચી પડેલા લાલ ઝૂમખાંવાળા ફૂલોનાં ગુચ્છ મને સ્પિત આપી રહ્યા... તેમના કોમળ સ્પર્શને માણીને હું સહેજ આગળ ચાલી ત્યાં ગુલાબી રંગના કરેણ મને પાસે બોલાવી રહ્યા હતાં. હું તેમની પાસે ગઈ ત્યાં તો સૂરજમુખી મારાથી રિસાઈ ગયા.

“તને અમે દેખાતા જ નથી!” એમની મીઠી ઈર્ઝા જોઈને હું હસી પડી.

ભરચક બોરસલ્ટીનાં ખરી પડેલાં પાન પાસે ઘડીક રોકાઈને હું આકાશ તરફ દિશે માંડી રહી હતી. સૂરજનાં પ્રાથમિક ડિરણો સોનેરી ઉજાસ ફેલાવી રહ્યા હતાં. મારી આસપાસ પીળા ગલગોટાની બિધત હતી અને તેના પર બાજેલા ઝકળબિંદુઓની ભીનાશ. મન પ્રકૃતિનાં સ્પર્શથી તરબતર હતું. બગીચાની ફરતે ચાર ચક્કર મારીને હું બાંકડા પર નિરાતે બેઢી. સામે ઊગેલા કુમળા ધાસની પથારી સહેજ ભીની હતી. મારી આંખોને શાતા આપતા નજરા હું મનભરીને પી રહી હતી.

“આટલું સુંદર વાતાવરણ છે પણ ગરમી બહુ છે નહીં?” મારી પાસે બેઠેલા એક અજાયા આધેડ વયના ભાઈને મેં સહેજ પ્રશ્ન પૂછ્યો. તે મારી તરફ એક મીનિટ સુધી જોઈ રહ્યા પછી ધીરેથી બોલ્યા, “હા, ગરમી તો છે.”

એમના ટ્યાંક જવાબથી મને નવાઈ ન લાગી, પણ હાવભાવ જોઈને ચોક્કસ લાગી. તેમની આંખો પાડાના ડોળાની જેમ બહાર આવી ગઈ હતી, વાતચીત દરમિયાન તેમના ચહેરાનો હાવભાવ એકદમ સ્થિર હતો. મારા પૂછયેલા સામાન્ય અને સહેજ પ્રશ્નના

જવાબ પણ તે ખૂબ ગંભીર રીતે આપતા હતા. તે દેખાવમાં સાવ સામાન્ય અને સીધા લાગતા હતા.

મેં વાતનો દોર ત્યાં જ અટકાવીને ચાતવાનું શડું કર્યું બગીચામાં રાખેલા એક કસરતના મરીન પર તે ચઢી ગયા અને જાણે શરીરમાં ૪૦૦ વોટનો પાવર આવી ગયો એમ જોરજોરથી ધૂળાવા લાગ્યા. એમની હરકત જોઈને હું સહેજ હેબતાઈ ગઈ. પણ કોઈ રિએક્શન આપ્યા વિના ચાતવા લાગી. થોડીવાર પછી એ ટ્રેડમિલ જેવા સાધન પર ચઢ્યા અને જાણે તેની સાથે જગે ચઢ્યા હોય એમ મોઢા પર શૌચનો ભાવ લાવીને દોડવા લાગ્યા.

“નક્કી કંઈક ગરબડ છે!!” મારા મનમાં તેમને જોઈને ભાતભાતના વિચારો જન્મવા લાગ્યા. ન ઈચ્છા છતાંધ હું એમને શંકશીલ દશ્ચિથી જેવા લાગી.

“આપણો શું કામ કોઈના પ્રત્યે જજમેટલ બનવું જોઈએ?”

હું મન મનાવી ઘરે આવી ગઈ. પણ આખા રસ્તે આ વીફરેલા વરુ જેવા ભાઈની હરકતો મને યાદ આવતી રહીંદી.

“એ ભાઈ કેમ આમ કરતાં હશે? ક્યારેક આકમક અને ક્યારેક સ્થિતિસ્થાપક કેમ થઈ જતા હશે?”

“જે હોય એ, તું તારું કામ કરને ભાઈસા’બ.” મારું મન મને સમજાવી રહ્યું હતું.

બીજા દિવસે ફરીથી હું એ જ સ્થાન પર બેસીને ઊગતી સવારનું વિટામિન ડી ગ્રહણ કરી રહી હતી. પેલી ગઈકાલવાળી વિભૂતિ ફરીથી પ્રગટ થઈ. મારી આસપાસ આવેલાં સાધનો પર તેમણે પગ જમાવ્યો. હું થોડી ગભરાઈ ગઈ.

“પણ્યા, મારે પણ આવવું છે..”

એક ત્રણ વર્ષનું નાનકદું ભૂલકું તેમના પગ પાસે ઊભું રહીને જુદ કરી રહ્યું હતું. એની કાલીઘેલી ભાષા અને નિર્દીષ્ટા જોઈ હું એની તરફ આકષેદી.

“આ ભાઈની ઉંમર તો સારી એવી લાગે છે, પણ બાળક આવવું નાનું? અદ્ધી સદી ફટકરેલા પુરુષનું એક ઓવર

જેવનું બાળક? કંઈક તો ગરબડ છે..” હું આશ્વર્યના ભાવ સાથે એ પુરુષને જોતી રહી.

પેલું નાનકડું બાળક આખા બગીચામાં આમતેમ દોડવા લાયું પાછા પેલા ભાઈ પણ તબલાના વિલંબિત તાલ જેવી ગતિ સાથે દોડી રહ્યા હતા..

તેમની ચાલ અને દોડ પણ નોર્મલ વ્યક્તિ કરતાં જરા જુદ્ધી હતી. હું બાપ-દીકરાની હરકતો ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. એ જે રીતે બાળક સાથે મસ્તી કરતાં હતા એમાં હાસ્યની ખોટ વર્તાતી હતી. જાણે એમના જીવનમાં હાસ્ય નામનું ચેપ્ટર જ વિધાતા લખવાનું ભૂતી ગયા હતા. પણ આવું કેમ?

“કંઈક તો ગરબડ છે?” મારા મગજની સર્કિટ ઓન થઈ અને મારી અંદર બેઠેલો ડિટેક્ટિવ સભાન થયો. આ વ્યક્તિની કુંડળી મારે જેવી પઢશો..આખરે આ ભાઈને તકલીફ શું છે?”

“તું શાંતિ રાખને.. તારે શું પંચાત? એ ભાઈ એના બાળક સાથે હસ્તીને રમે કે રડીને રમે એમાં તારે શું? તું શું કામ લય કરે છે?” ફરીથી મારું મન મને ટોકવા લાયું.

એ ખીલાભિલાતા બાળકની હરકતો જોઈ હરખાઈને હું ઘરે પાણી આવી. પણ મારા ન દીચ્છવા છાંચ મારા મગજમાંથી પેલા ભાઈનું વર્તન ભૂલાતું નહોતું..

“એ માણસ ભાવશૂન્ય કેમ છે? એ કેમ એવું વર્તન કરે છે? નક્કી કંઈક તો ગરબડ છે..”

થોડા દિવસો હું ઘરમાં અત્યંત વ્યસ્ત હતી. બોરસલ્ટી અને સૂરજમુખી મને ઈમેલ કરીને મળવા બોલાવી રહ્યા હતાં. પારિજીત પણ મારા પર વરસવા આતુર હતાં. અને પેલા પીળા ગલગોટા મારા કાનમાં કેંક કહેવા માંગતા હતા.

“તમે બધા મારા વિના સૂના થઈ ગયા ને! હું આવું છું તમને મળવા..”

થોડા દિવસો બાદ હું વહેલી સવારે મારા મિત્રોને મળવા બગીચામાં આવી. બોગનવેલ અને ચંપો સહેજ

ગુસ્સામાં હતા. કણીમાંથી વિકસિત થઈને ઉંગલું લાલ રંગનું ગુલાબ પણ સહેજ ચિડાઈ ગયું હતું. મેં એ તમામને બદલથી સ્પર્શ કર્યો..

“સોરી.. હું થોડી બીજી થઈ ગઈ હતી. પણ તમને ભૂતી નહોતી..”

પીળા કરેણના પીપૂડી જેવા ફૂલો મારા પર ભરીને મને વધાવી રહ્યા હતા. એકવાર ફરી હું મારા પ્રાઇતિક મિત્રો સાથે જૂમી ઉઠી. પર્ણ, પુષ્પ, વૃક્ષ અને લીલાઘન્ય ધાસ પર બાંઝેલી ઝકળને મળીને ચાર ચક્કર પૂરા કરી હું બાંકડા પર આસન જમાવીને બેઠી.

“એય.. જરા ધીરે ધીરે હંકો.. કઉ છું. બૌ ઉતાવળ નો કરો..”

મારા અને પ્રકૃતિ વચ્ચેના સાથુભ્યને તોડતો એક અવાજ મેં સાંભળ્યો. મારાથી પચાસ મીટરનાં અંતરે એક મહિલા ઉભી હતી. એ જેને ઉદ્ધરીને રડો પાડતી હતી એ બીજું કોઈ નહીં પણ પેલા ભાઈ જ હતા.

“ઓહ, આ બેન એમના પત્ની લાગે છે..”

મેં તેમને પણ ધ્યાનથી જોયા.. એ બિલકુલ નોર્મલ હતાં. તેમના હાવભાવ અને હલનચલન પણ તદ્દન સ્વાભાવિક હતાં. તેમની કાખા ચાલીસી વટાણેતી મહિલા જેવી સહેજ પાકટ લાગતી હતી. પણ પગ પાસે રમતું પેલું નાનકડું બાળક જોયું ત્યારે મને તેમની ઉમર વિષે શંકા થઈ.

“જે આ બહેન ચાતીસ વર્ષ ઉપરના હોય તો ઓફિસિયલી તેમનું બાળક કોલેજમાં જતું હોય એવનું મોટું હોયનું જોઈએ.. પણ આ તો હજુ નર્સરીમાં પણ નહીં જતું હોય એવું લાગે છે..”

“નક્કી કંઈક તો ગરબડ છે..”

આધે વધના પતિ-પત્ની અને અંગ્રોહા જેવા બાળકના અનોખા પરિવારને જોઈ હું ઘર તરફ ચાલી.

બે-ત્રણ દિવસ મારા મગજમાં જાતજાતની ગાણતરીઓ

ચાલી.. મારા મનમાં બધા જ સરવાળા ખોટા પડી રહ્યા હતા. જે દિવસથી પેલા ભાઈને જેયા હતા એ દિવસથી મારું મગજ થોડું અસ્તિત્વસ્ત થઈ ગયું હતું. હું શક્નાનું સમાધાન શોધી રહી હતી.

થોડા દિવસો પછી ફરીથી મને પેલો પરિવાર દેખાયો. આ વખતે પતિ સહેજ હું ઊભા હતા. નાનકડું બાળક પણ એના જેવા ભૂલકાઓ સાથે રમી રહ્યું હતું. હું બાંકડા પર બેઠી હતી અને પેતી સ્ત્રી મારી બાજુના સાધન પર કસરત કરતી હતી. મેં મોકા પર ચોકો મારવાનું નક્કી કરી લીધું.

હું ધીરેથી તેમની પાસે સરકી અને પૂરેપૂરી સૌજન્યતાથી હળવેથી પૂછ્યું.

“બેન, આ તમારા પતિ છે?”

“હા..” કસરત કરતાં કરતાં તેમણે સહજતાથી જવાબ આપ્યો.

“તેમને કોઈ તકલીફ છે?”

“તકલીફ એટલે?”

“આઈ મીન કોઈ માનસિક..?”

મારો પ્રશ્ન સાંભળીને તેણે જોરદાર બ્રેક મારી અને કસરતના સાધન પર દોડવાની ગતિ થંબાવી દીધી. થોડી ક્ષાળો તે મારા ચહેરાને આંખો ફાડીને જોઈ રહી. જાણે સવાલ કરતી હોય કે ‘તને શું પંચાત છે?’

તે કંઈ બોલી નહીં પણ મારી પાસે બાંકડા પર આવીને બેઠી. તેના ચંદ્રમા જેવા ગોળ ચહેરાને મેં ખૂબ પાસેથી જેયો. તેની આંખો ગંભીર અને આંસુથી તગતગી રહી હતી. તેના રેશમી વાળનાં ગુરુછમાં છૂટાછવાયાં વાદળો જેવા કેટલાક સફેદ વાળ પણ હતા. ચાંદી જેવી ત્વચા પર પિતળ જેવા દર્ઢની રેખાઓ ઉપસેલી હું જોઈ શક્તી હતી. બે ત્રણ મિનિટના મૌન પછી તેનો અવાજ સંભળાયો.

“હા બેન.. મારા પતિને તકલીફ છે..” મારી આશંકા સાચી પડી. એ વ્યક્તિ ખેઠભર કોઈક રોગથી પીડાતી હતી.

“શું થયું છે બેન તમારા પતિને?”

“પાર્કિન્સન.”

“ઓહ માય ગોડ..” મારા બધા પ્રશ્નના જવાબો એક શબ્દથી મળી ગયા.

“અયારથી તકલીફ છે?”

“છેલ્લા ૧૦ વર્ષથી..”

“કોઈ દવા ?”

“દિવસની આઠ ગોળી લે છે. એક દિવસ ચૂકી ગયા તો..... એવું હું નહીં, ડેક્ટર કહે છે..”

તેનું દર્દ હું સમજી શક્તી હતી.. થોડી ક્ષાળો અમારી વચ્ચે મૌન પથરાઈ ગયું. હું તેને વધારે પ્રશ્નો પૂછીને તેના ધાને ખોતરવા નહોતી માંગતી..

“મમ્મી.. મને ન્યા લઈ જાઓ..” પેલું નાનકડું બાળક તેનો દુપણો બેંચી રહ્યું હતું.

એને જોઈને મને મારો બીજો સવાલ યાદ આવ્યો.

“તમારી ઉંમર તો વધારે લાગે છે, પણ આવું નાનું બાળક?”

“હા, અત્યારે વિજાનની મદદથી પાકટ વયે પણ બાળક પેદા કરવું શક્ય છે.”

તેણે ફરીથી ચહેરા પર ગંભીરતા ધારણ કરી. બાળકને રવાના કરીને મારી સામે જોયું.

મારી ઉંમરનો અંદરું તમને આવી જ ગયો હશે, પણ મારા દુઃખનો પાર તમે નહીં પામી શકો..

“એવું કેમ બોલો છો, બેન?”

“બેન, મેં ૧૫ વર્ષનો દીકરો કેન્સરમાં ગુમાવ્યો છે.. એ જીવતો હોત તો અત્યારે મારો સહારો થાત..”

“હે ભગવાન!” તેનો જવાબ સાંભળીને મારી છતી ચિરાઈ ગઈ. એક મા પર શું વીતી હશે, જ્યારે તેણે પોતાનું પંદર વર્ષનું બાળક ગુમાવ્યું હશે. તેની આંખો બાળકને યાદ કરીને છતકાઈ ગઈ. એક તરફ પતિની બીમારી અને બીજી તરફ એકના એક પુત્રનું મોત. બધ્યે કારમા ઘા

તેની ધાતી ઝીલી ચૂકી હતી. મારે પૃથ્વાની જરૂર ન પડી. એ નાનકડું ત્રણ વર્ષનું બાળક કેમ એના ખોળે રહે છે?

“તમને જિંદગી સામે કોઈ રોષ નથી બેન?”

“રોષ કોની સામે કાઢવાનો? કુદરત સામે, નસીબ સામે કે પરિસ્થિતિ સામે..” એ જવાબ આપતા હુસ્તાં ચહેરે રોઈ રહી હતી.

“છેલ્લા દસ વર્ષથી તમે પતિની સેવા કરો છો.. ઘન્ય છો તમે..”

“હા બેન. છેલ્લા શાસ સુધી સાથ નિભાવીશ..”

તેનું ફળતું યૌવન પ્રેમની સાચી વ્યાખ્યા આપી રહ્યું હતું.

નાનું બાળક તેના પગ પાસે આવ્યું ત્યારે તેને આંસુભરી આંખે ચૂમીને તે પતિનો હાથ પકડીને ચાલી નીકળી..

એ દશ્ચિંદ્રી અદર્શ થઈ ત્યાં સુધી હું તેને ભીની આંખે જોતી રહી.. એના સમર્પણને મેં મનોમન વંદન કર્યા.

★★★★★

“ટિકિટ ટિકિટ..”

“બેન.. ટિકિટ લઈ લો..”

હું બારી પાસેની સીટ પર બેઠી હતી. કંડકટરની હંક સાંભળીને મારું ધ્યાન બહારથી અંદર આવ્યું.

પર્સ્સમાંથી પૈસા કાઢીને મેં કંડકટરને આપ્યા. તેમના હાથમાંથી ટિકિટ લઈને મેં ફરીથી મારું ધ્યાન બારીમાં પરોવ્યું. મારી બાજુની સીટ ખાલી હતી..

આગળના સ્ટેશન પરથી એક સ્ક્રી બસમાં ચઢી. તે આવીને મારી બાજુની સીટમાં ગોઢવાઈ ગઈ. મારું ધ્યાન તેની તરફ ગયું. તેના ચહેરા પરથી તેની ઉંમર આશરે ત્રીસની આસપાસ લાગતી હતી. તેની માંજરી આંખો અને ઉજળો વાન મંદાકિનીની યાદ અપાવતા હતા. તેને જોઈને હું બે દાયકા પાછળના બોતીવુડમાં

સફર કરી આવી. તેના લીસ્સા સુંવાળા વાળ હવામાં ફરફરી રહ્યા હતા. એક આછેરી ઝલકમાં મેં તેના સૌંદર્યનું માપ કાઢી લીધું. પણ તેનાથી વધુ આશ્ર્ય મને ત્યારે થયું જ્યારે મેં તેના ખોળામાં એક રૂના ડગલા જેવી દીકરી જોઈ.

“શું નામ છે બેટા?”

“પરિ..”

“ઓહ વાવ..સો ક્યાટ્.”

“બહુ સુંદર દીકરી છે તમારી..”

એની મા મને જોઈ રહી.. તેણે કોઈ જવાબ ના આપ્યો. ના સ્મિત આપ્યું ના હોકારો, ના કોઈ ઈશારો. તેનો ચહેરો ભાવશૂન્ય હતો.

“જબતી બાઈ છે..” હું મનોમન સહેજ ચિડાઈ..

“શેન્ક યુ..” લગભગ અઢી મિનિટ પછી મને પહેલીવાર તેનો રૂપાની ઘંટડી જેવો મંજૂલ સ્વર સંભળાયો.

મેં નજર બારીમાંથી હટાવી તેની તરફ માડી. પેતી નાનકડી દીકરી મારી તરફ જોઈને શરમાઈ રહી હતી.

પણ તેની માના ચહેરા પર મને ભાવની કમી દેખાઈ.. અને મારા મનમાં થયું.

“નક્કી કર્દી ગરખડ છે.”

મેં તેને ખૂબ ધ્યાનથી જોઈ.. જાણે એક રોબોટ, એક રૂપાળો, જીવંત અને માતૃત્વ પામેલો રોબોટ.. જે બધું જ સમજતો હતો પણ તેનું હદ્ય માણસની જેમ ઘબકતું નહોતું.

મારા મનમાં આશંકાઓના તોતિંગ મિનારા જૂતી રહ્યા હતા.

“કદાચ આ સ્વી પણ પેતા ભાઈ જેવી બીમારી તો નથી ભોગવી રહી ને!!! ઓહ નો!!!”

હું તેને વધારે કંઈ પૂછું એ પહેલા એક સાઈઠ વર્ષના બા અમારી સીટ તરફ આવ્યા.

“દીકરી હુંભાળીને ઊતરજે..”

તેણે મોટી આંખો ઓર મોટી કરીને તે બાની સામે જોયું..

“નક્કી કંઈક ગરબદ છે..”

“બા, બધું બરાબર છે?” બા કદાચ આ સ્વીની મા હતાં..

“હા બેન, આમ તો બધું બરાબર છે, પણ ભગવાન બરાબર રે'વા નથે દેતો.”

“હું સમજી નહીં, બા..” તે મારી સામેની સીટ પર બેઠા.

“આ મારી દીકરી સે.. ઈનો ધણી એને રાખવા રજી નથી..”

“તમારી દીકરી તો બહુ જ રૂપાળી છે, અને વળી આ નાનકડી ઢીગલી પણ કેટલી સુંદર છે.”

“એ બધું હાચું બેન.. પણ મારી દીકરીને..”

“કોઈ બીમારી છે?”

“હા બેન.. બર્યું પેલું શું કે સે ઈને... પાર્કિંગ..”

“પાર્કિંગ નહીં બા.. પાર્કિન્સન..”

“હા હા એવહું ઈ જ..”

“ઓહ નો.. પણ એ આટલી નાની વયે થઈ શકે?”

“અવ તો નાના નાના સોકરાવને અટક આવશ... મારી દીકરી તો બૌ મોટી સ..”

“પણ આ બીમારી તો વડીલોને થાય છે ને?”

“દાક્તર આવું જ ક'તાતા.. પણ હોમાંથી એક જવાન માણણને પણ આ દરદ લાગુ પડે સે..”

મેં એમની વાતની ખરાઈ કરવા ગૂગલમાંથી જવાબો શોધ્યા. એમની વાત સાચી હતી. માત્ર ૧% લોકોને આ બીમારી પચાસથી નાની વયે પણ થાય છે.

“આવી બીમાર બાયડીને કોઈ આખી બિંદગી નો પાલવે.. લગનના પાંચ વર્ષ પછી ઈન આ બીમારી લાગુ પડી.. ઈની ચાકરી નો કરવી પડે એના હાદું મારી દીકરીન....”

બાનું અધૂરું વાક્ય ડૂસકાંથી પૂરું થયું.. હું પરિસ્થિતિ પામી ગઈ.. થોડીવાર પછી સ્વસ્થ થઈ તેમણે ફરીથી બોલવાનું શક્ક કર્યું.

“ઈનો બાપ બે વર્ષ પહેલા જ કેન્સરમાં ગુજરી ગયો. ઘરમાં તંગી, તકલીફ અને તમશાનો પાર નથી.. પણ એ મારી દીકરી સે.. છેલ્લા શ્વાસ સુધી એની સેવા કરીશ.. એની મા સુ બેન..”

કંકટરે ઘંટડી વગાડી.. બસ ઊભી રહી.. ત્રણ પેઢીને એક સાથે એકબીજાને સાચવીને નીચે ઊતરતા હું જોઈ રહી.. બસ આગળ વધી. મેં ફરીથી બારીની બહાર નજીર પરોવી..

“બીમાર બાયડીને કોઈ જીવનભર નો હાચવે..” બા ના શાખાનો મારા મનમાં ગુંજુ રહ્યા હતા.

અચાનક મને બગીચામાં મળેલી પેલી આધુનિક સાવિત્રી યાદ આવી..

“છેલ્લા શ્વાસ સુધી મારા પતિને સાચવીશ..” એના સમર્પણને મેં મનોમન વંદન કર્યા.

બી/ર, શિલ્પ ગાળેશ ટેનામેન્ટ,
અક્ષર ફાર્મ સામે, આણંદ-વિદ્યાનગર રોડ,
આણંદ, (મો) ૯૮૦૪૨૩૭૮૪૭

**મહેનતજું ફળ અને સમસ્યાઓનો ઉકેલ પ્રામાણિકતાથી યોગ્ય દિશામાં કામ
કરનાર લોકોને એક દિવસ ચોક્કસ મળે છે.**

જીવન ભલે ગતે તેટલું મુશ્કેલ જોવા મળે, પરંતુ આપણે દરેક પરિસ્થિતિમાં કંઈકને કંઈક
સાંચું કરી શકીએ છીએ. માત્ર પોર્ટિટિવ વિચારોની જરૂરિયાત છે.

॥ विदेशवासीनी वतन वंदना ॥

विदेशमां वसवाट करता भारतीय नागरिक विदेशमां मृत्यु पाम्या होय अने देशमां तेनो पार्थिव देह लावीने तेनुं देहदान कर्यु होई तेवी देशनी सौप्रथम घटना.

अंगदानना क्षेत्रमां कार्य करती 'डोनेट लाईफ' संस्थाना ट्रस्टी प्रकाशभाई पटेल अने तेमना परिवारे पोताना जुवानज्ञेध पुत्र स्व. प्रजेश (उ.व. ३६) नुं देहदान करी समाजने नवी दिशा बतावी उत्तम उदाहरण पूर्ण पाइयु.

चरोतर पंथकमां सौथी नानी उंमरना युवानना देहदाननी आ सौ प्रथम घटना छे.

मूळ आणंद जिल्हाना ओड गामना वतनी, हलमां मुंबई खाते रहेता अने ईसरोमां ईलेक्ट्रिकल सर्किट, गोल्ड एंटिंग सप्लायनुं काम करता अने अंगदाननी जनजगृति भाटे समाजमां कार्य करती संस्था 'डोनेट लाईफ'ना ट्रस्टी प्रकाशभाई पटेलनो सुपुत्र प्रजेश उ.व ३६ तेना परिवार साथे केनेडामां रहेतो हुतो अने बेकरीनी दुकान चलावतो हुतो. रविवार ता. २१ ओप्रिलना रोज प्रजेशने झाडा-उलटी थतां होस्पिटलमां दाखल कर्यो हुतो. थोडा कलाकोनी सारवार पढी तेनुं ब्लड प्रेसर घटी जतां तेमज ओक्सिजन लेवल ओछुं थर्ड जतां तेनुं मृत्यु थयुं हुतुं. जेनी जाण मुंबईमां रहेता प्रजेशना भाता-पिता प्रकाशभाई अने आरतीभेनने करवामां आवी हुती.

आ हुःभनी घडीमां अंगदानना क्षेत्रमां कार्य करता 'डोनेट लाईफ'ना ट्रस्टी प्रकाशभाई अे एक पण्नो विलंब कर्या वगर जणाव्यु के तेमना पुत्र प्रजेशनी आंभोनुं दान करावीने बीजु व्यक्तिने रोशनी आपो, परंतु होस्पिटलमां आंभनुं दान थर्ड शक्युं न हुतुं. स्व. प्रजेशना पार्थिव देहने अभ्यालिंगनी रासायणिक प्रक्रिया करीने मोर्गमां

मूळवामां आव्यो हुतो अने तेना पार्थिव देहने भारत लाववा भाटेनी तेयारी शड करवामां आवी हती.

सोमवार ता. २८ ओप्रिलना रोज स्व. प्रजेशना पार्थिव देहने अे ईन्डियाना विमान भारक्षत टोरेन्टोथी दिल्ही, दिल्हीथी अमदावाद, अमदावादथी अभ्युत्तन्स भारक्षत ओड गाममां लाववामां आव्यो त्यारे वातावरण खूब ज गमगीन भनी गयुं हतुं अने हृदयद्रावक दृश्यो सज्ज्या हता. स्व. प्रजेशना पार्थिव देहने समयसर दिल्हीथी अमदावाद अे ईन्डियाना विमान भारक्षत समयसर पहोंचाडवा भाटे नागरिक उहूयन भंगी श्री ज्योतिराहित्य सिंधिया अने आणंदना सांसद श्री भीतेशभाई पटेल (बकाभाई)-नो सहकार सांपड्यो हुतो.

आ हुःभनी घडीमां स्व. प्रजेशनी धर्मपत्नी सेजल, पिताश्री प्रकाशभाई, भाता आरतीभेन, ससरा हरीशभाई, सासु कोकिलाभेन, तेमज प्रकाशभाई पटेलना परिवारज्जनो अे निर्णय कर्यो के स्व. प्रजेशनो अंतिम संस्कार करवाने बदले भेडिलना विद्यार्थी अने शरीरनी अनेटोभी शीखवा भाटे स्व. प्रजेशना देहनुं दान करवुं जोईच्यो.

स्व. प्रजेशना पार्थिव देहनुं दान करवाने निर्णय थता ज्ञ.जे.पटेल ईन्स्टिट्यूट ओड आयुर्वेदिक स्टडीज एन्ड रिसर्च, सीवीएम युनिवर्सिटी, न्यू वल्सब विद्यानगरना डीन डॉ.सी. एस. बाबरियानो संपर्क करवामां आव्यो अने तेओच्यो स्व. प्रजेशना देहनुं दान स्वीकार्युं.

उल्लेखनीय छे के, विदेशमां वसवाट करता भारतीय नागरिक विदेशमां मृत्यु पाम्या होय अने देशमां तेनो पार्थिव देह लावीने तेमनुं देहदान कर्यु होई तेवी देशनी आ सौ प्रथम घटना छे. तदृपरांत चरोतर पंथकमां पाण सौथी नानी उंमरना युवानना देहदाननी सौ प्रथम घटना छे. स्व. प्रजेश आणंदमां 'डोनेट लाईफ' संस्था साथे जेडाईने हुंमेशा अंगदाननी जनजगृति भाटे कार्य करतो हुतो. स्व. प्रजेश तेना

મૃત્યુ પછી, તેના દેહદાન થકી મેડિકલના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદગ્રદ્ધ બનશે.

સ્વ. પ્રજ્ઞેશના પરિવારમાં તેની ઘર્મપત્ની સેજલ ઉ.વ. ૩૬, જે કેનેડામાં વસવાટ કરે છે અને શિક્ષિકા છે, પુત્ર વિહાન ઉ.વ. ૧૩ જે ધોરણ ૮ માં, પુત્રી મહીકા ઉ.વ.૮ જે ધોરણ-૫માં કેનેડામાં અભ્યાસ કરે છે, પિતા પ્રકાશભાઈ ઉ.વ.૬૬ મુંબઈમાં રહે છે અને ઈસરોમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ, ગોલ્ડ પ્લેટિંગ સપ્લાયનું કામ કરે છે, માતા આરતીબેન ઉ.વ.૬૪ ગૃહિણી છે, બે બહેનો પૂજા અને ચાંદની પરણિત છે અને અમેરિકામાં તેઓના પરિવાર સાથે રહે છે.

આ દેહદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં સ્વ.પ્રજ્ઞેશની પત્ની

સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબેન તથા સમગ્ર સૂર્યજદારી પરિવાર, સસરા હરીશભાઈ, સાસુ કોકિલાબેન, બહેનો પૂજા અને ચાંદની, CVM એક્ઝિયુક્ટિવ બોર્ડના મેમ્બર શ્રી પ્રદીપભાઈ પટેલ, કિરણભાઈ પટેલ (કોઝી), રેડકોસ આણંદના શ્રી શૈલેશભાઈ પટેલ, CVM યુનિવર્સિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ પટેલ, વાઈસ ચેરમેન શ્રી મનીષભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો.

ધ્યાન છે... વંદન છે...પ્રણામ છે...સલામ છે...સ્વ.પ્રજ્ઞેશની ઘર્મપત્ની સેજલ, માતા-પિતા પ્રકાશભાઈ અને આરતીબેન તેમજ સમગ્ર સૂર્યજદારી પરિવારને આ દુઃખની ઘડીમાં કાળજા ઉપર પથ્થર મૂકી જીવાનજોધ પતિ/પુત્ર સ્વ.પ્રજ્ઞેશનું દેહદાન કરી સમાજને નવી દિશા બતાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ.

દરમિયાન મારે દર બે મહિને તેમના અભ્યાસની પ્રગતિની જાણકારી અને પ્રોત્સાહન અર્થે વિદ્યાનગર આવવાનું થતું હતું. વિદ્યાનગરનો શૈક્ષણિક માહોલ, સ્વચ્છતા અને ઘટાદાર વૃક્ષોનો શીતળ છાંયો જોઈને અભિભૂત થઈ જવાયું હતું. મનમાં થતું કે આ વિદ્યાનગરીમાં રહેનાર કેટલા ભાવ્યશાળી હશે! જિંદગીની ઉત્તરાખસ્થામાં-ભવિષ્યમાં અહીં વસવાટ કરવાના બાલીશ વિચાર એ સમયે મારા મન પર કબજો જમાવતા હતા.

અસંખ્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ચારુતર વિદ્યામંડળ હેઠળની ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરીને વિદેશોમાં સ્થાયી થયા છે. આ બધાનો યશ આર.પી.ટી.પી. સ્કૂલ તેમજ વિશ્વાળ વિદ્યાસંકુલમાં આવેલ વિવિધ ફેફલ્ટીની કોલેજો, અનુસ્નાતક ભવન, સીવીએમની યુનિ. વગેરે સંસ્થાઓની સુદ્ધ શૈક્ષણિક પદ્ધતિ, અનુભવી અને ઉમહા શૈક્ષણિક સ્ટાફ અને કેળવાળીને સર્મેપિત એવા આ સંસ્થાના પ્રવર્તમાન અદ્યકશી, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી અને સહમંત્રીશ્રીઓ ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ, કાર્યવાહકશ્રી ઓના ફાળે જાય છે.

ટાઈટન-૫૪, સી-૪૦૨, રિલાયન્સ મોલ પાછળ,
સિલ્વર સ્ટોન મેર્ચિન રોડ, રાજકોટ
પીન કોડ-૩૬૦૦૦૧, (મો) ૭૬૬૮૧૬૦૧૬૦

॥ વાચકનાં પત્રો ॥

વિદ્યાધામ - વલ્લભ વિદ્યાનગર

પી. એમ. લુણાગરિયા

વલ્લભ વિદ્યાનગર અને ચારુતર વિદ્યામંડળ સાથેનો મારો અનુભંધ ૧૯૯૦ ની સાતથી અકબંધ છે. આજે પણ મારા દિલના એક ખૂણે “આર.પી.ટી.પી. સાયન્સ સ્કૂલ”ની સ્મૃતિઓ સચ્ચાયેતી પડી છે. “વિ-વિદ્યાનગર”નો અંક હથમાં આવતા જ એ સ્મૃતિઓ જાગી ઉઠે છે અને મનઃચક્ષુ સમક્ષ વિદ્યાનગરની ભૂમિ અને “ચારુતર વિદ્યામંડળ” સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના ભવ્ય બિલ્ડિંગ તાદ્દશ થાય છે. સરદાર સાહેબની દીર્ઘદિશા, પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિશ્વાળ વિદ્યાસંકુલની સ્થાપના થઈ. જેના પાયાના પથ્થર સમાન આદ્યસ્થાપકશ્રી ભાઈકા, ભીખુભાઈ પટેલ અને અન્ય ગણમાન્ય ટ્રસ્ટીશ્રીઓ, કાર્યવાહકો અને દાતાઓને યાદ કરીને હું આદરપૂર્વક શાલ શત વંદન કરું છું.

મારા બંને સંતાન (સુનીલ અને તુલાર) અનુકૂમે વર્ષ ૧૯૯૦-૯૧ અને ૧૯૯૩-૯૪ વર્ષ દરમિયાન “આર.પી.ટી.પી. સાયન્સ સ્કૂલ”માં સ્ટાન્ડર્ડ ૧૧-૧૨ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરેલ હતો. એ વર્ષો

॥ લલિત નિબંધ ॥

ઉડાડી કરે એ પંખીઓ...

સિવાસ પટેલિયા

પંખીઓ સાથે મારી દોસ્તીના મૂળ બહુ ઊંડા છે. સમજણ ફૂટી ત્યારથી કહી શકાય. બોલતાં આવડતું નહોતું. ત્યારેય આંગણે ચણ ચણતાં, ઉડાડીઓ કરતાં, છાપરે બેસીને એ કલબલાટ કરતાં, અહીં તહીં બેસતાં, અકળવકળ જોતાં, માથું હલાવતાં એ પંખીઓને મારી આંખ જોતી ! એ પછી એ પંખીઓના અવાજને સાંભળ્યા કરવાનું ગમતું રહ્યું હશે. શાળાએ જતાં આવતાં, રજના દહાડે કે વેકેશનમાં રોજે રોજ ખેતરોમાં સીમમાં રખડતાં રજગતાં જોયેતાં એ પંખીઓ.. વર્ષોના વર્ષો લગી જોયેતાં એ પંખીઓ.. મનોમન એની જોડ વાતો કરતો. એનાં ગાન અને રૂપને હૈયે વસાવીને આનંદ માણેલો ! એ પંખીઓ ! ઘરઆંગણાનાં ને સીમમાં એ પંખીઓ ! ચકલીઓ, લેલાં, હોલા, કબૂતર, કાગડા, કાબરો, બુલબુલ, પોપટ વગેરે ઘરઆંગણે જોતો... સાંભળતો. સ્ફૂર્તા, કાળિયો કોશિયો, લેલાં, કકડિયો કુંભાર, હૈયડ દેવચકલી ને બીજા ઘણાં બધાં જેમના નામ તો પછી જાણ્યા. એ બધાં ખેતરોમાં સીમમાં જોવા મળતાં. એ બધાં જોડેય સંબંધ હૈયે સ્થાપેલો. એ બધાં વિશે એક એક લલિત નિબંધ લખી શકાય. જે પંખીઓ થોડા સમય પર જોયાં એ વળી આ પંખીઓથી નિરાળાં ને અત્યંત રૂપાળાં ! એની હવે વાત માંડું ! જો કે બધાં જ આ ક્ષણે પણ મારા મનમાં ઉડાડી કરે છે. ગાય છે. સાંભળતો રહું છું...

થોડા સમય પહેલાં ડિસ્કવરી ચેનલ પર પંખીઓ વિશે એક વૃક્ષચિત્ર (ડોક્યુમેન્ટરી) જોયેલું. એનું નામ તો યાદ નથી. એ પંખીઓ જોઈને વિસ્તીર્ણ થઈ જવાયું. એ પંખીઓની સાથે સાથે મને મારા

પંખી દોસ્તોય દેખાયાં. ખૂબ મજા પડી. હજુય આંખ સામે દેખાય છે. દરિયો ! ઉઇણતાં મોજાંઓ. ઘેઘૂર અવાજ. આવા વાતાવરણમાં આ પંખીઓ જુઓ ! ઢળતી સાંજના કિનારે અહીં બારી પાસે બેઠો છું પરંતુ મનોમન તો દરિયાકઠે પહોંચી ગયો છું. એ પંખીને જોડું છું. કાળારંગનું લાંબુ માથું, સર્ફારંગના પીંછાથી ભરાયેલો દેહ, લાંબી સુંદર ચાંચ. રૂપાળું વહાલું લાગે એવું આ પંખી ! દરિયાના જળ પર ઉતરે છે, અતિ તીવ્રગતિથી ચાંચમાં એ માછલી પકડી લે છે. આ પંખી ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ ભણી યાત્રા ખેડે છે. દોઢમાસ આ યાત્રા ચાલે છે. ઉપર આકાશ, નીચે ઉઇણતો દરિયો ! એ ઉડતું રહે છે. એને જોતો રહું છું. વનવગડો આવે છે. પહણો, હુંગરો ને લીલાછમ્ભ ઢોળાવો આવે છે. એને વળાવીને એ ઉડતું રહે છે. એને જોતાં જોતાં પ્રકૃતિના વિધવિધ રૂપોનેય જોતો રહું છું. એની જોડે વાતો ય કરું છું. રાત્રિના અંધકારમાં તારાઓ અને નક્ષત્રો જોતાં જોતાં, ચંદ્રકિરણોની શીતળતા માણાં માણાં, પાંખને ફેલાવીને ઉડ્યા જ કરવાનો કેવો રોમાંચ ! વાતાવરણ પલટાય. હંડી વધે ઘટે, તેમ છતાં એક ધ્યાને મજલ કાપતા ઉડવાનું ! રે પંખી ! જોને મારું મન પણ પંખી બની ગયું છે ને વળી સંગાથે સંગાથે ઉડી રહ્યું છે. તને ક્યાં ખબર છે ! હજુય તને જોડું છું. આકાશને હેઠ દરિયો જોડું છું !

આ આછાઆછા અંધકારમાં આ બીજાં વિવિધ પંખીઓ જે જોયાં હતાં એ બધાંય ફરી દેખાય છે. મન મારું ખૂબ જ આનંદથી છલકાઈ ગયું છે. બધાં જ આંખ સામે જે વિહરી રહ્યાં છે. સાવ પાસે જ. ભાતભાતના રંગ ! અલગ અલગ રૂપ ! આંખ, પાંખ, ચાંચ, પગ દરેકના અલગ જ ! બધાંય ઉડે છે. બેસે છે. વનવગડાનો વિસ્તાર છે. ઢોળાવ પર, વૃક્ષ પર એ દેખાય છે. મારું મન પણ એ જગાઓ ઉડી ગયું છે. પંખીઓ જુઓને તમારી સાથે જ તો છું. જોડું છું તમને વાહ ! પાંખ ફેલાવો છો... કિલ્લોલ

કરો છો... નૃત્ય કરો છો...મુખ્યકર નૃત્ય ! રમણીય દશ્યપટ રચાયું છે. અપલક નેત્રે બસ જોયા જ કરું છું.

આ શાંત વાતાવરણમાં ભારી પાસે બેઠો છું.
 પરંતુ મન મારું આ નદીના કંઠ પહોંચી ગયું છે.
 જોયેતી નદી ત્યારે જોયેતી પણ એની અમીછાપ વળી
 પાછી જીવંત થઈ ગઈ છે. નદીકાંડો. ઉપરવાસમાં
 વૃક્ષો ઝૂમી રહ્યાં છે. વૃક્ષોની સામે પહાડના ઢોળાવો
 છે. નદી પાસે ખેતર જેવી જગ્યા છે. સામે દુંગર ઊભો
 છે. કેટલા બધાં પંખીઓ ! ઊડતાં ઊડતાં નદીકાંદાની
 એ ખેતર જેવી જગ્યા પર જાય છે. ચાંચમાં મારી ભરે
 છે. દુંગરના ઢોળાવે જાય છે. ચાંચની મારી થથેડીને
 એ દુંગર પર માળો બનાવે છે. ઊડી જાય છે. ચાંચમાં
 મારી લે છે. માળો બાંધે છે. બધાં જ આમ પ્રવૃત્ત
 જોવાની મજા પડે છે. ઉપર નીચે અડખે પઢ્યે પાસ-
 પાસે માળાઓ રચાતાં જાય છે. મારીના માળામાં આ
 પંખીઓ રહે છે. વૃક્ષ પર, બખોલમાં, છાપરામાં
 માળા જોયા છે. મારીના આ માળા જોઈને આલા
 બની જવાયું. એની રચનાપ્રક્રિયા પણ કેવી મજાની !
 સામટા પંખીઓ ઊડી આવે...જાય...માળો બાંધે
 બનાવે. આ દશ્ય જ વિરલ ને મજાનું ! માળામાં
 ગયેલાં પંખીઓ એક સાથે બધાં જ બહાર ઊડી
 આવ્યાં એ દશ્ય તો અદ્ભુત ! સુંદરતમ ! ગતિરીલતા
 અને કિશોર ! હજુય એ દશ્યો દેખાયાં કરે છે. આ
 ફળતી સાંજ ને ઊઘડતો જતો અંધકાર ને પ્રગાહ
 શાંતિમય વાતાવરણમાં મારું મન એ પહાડી ઢોળાવ
 ને આ પંખીઓમાં તદ્દુપ થઈ ગયું !

હજુય એ બધાં જ પંખીઓ મારા હૈયામાં
 ઊડાઊડ કરે છે. એમને જોયા કરું છું ને આનંદથી
 છલકાતો રહું છું.

૨૦૧, સેફોન કલાસિક,
 એસ.બી.એસ.કોલોની, ડિલક્ષ ચાર રસ્તા,
 નિઝામપુરા, વડોદરા-૩૬૦૦૦૨,(મો) ૯૮૭૭૨૬૬૮૨૮

| વિ-વિદ્યાનગર | માસિક અંગેનું માહિતીપત્રક
 ફોર્મ-૪ (નિયમ-૮ મુજબ)

૧. પ્રકાશન સ્થળ	: વદ્વાલ વિદ્યાનગર
૨. પ્રકાશનની સામયિકતા	: માસિક
૩. મુદ્રક	: સી.વી.એમ. પ્રેસ, વદ્વાલ વિદ્યાનગર
૪. પ્રકાશકનું નામ	: ડૉ. એસ.જી.પટેલ
રાજ્યાયતા	: ભારતીય
સરનામું	: માનદ મંત્રી ચારુતર વિદ્યામંડળ, વ.વિદ્યાનગર-૩૮૮૧૨૦
૫. તંત્રી	: ડૉ. વર્ણિશ છાયા
રાજ્યાયતા	: ભારતીય
સરનામું	: માનદ મંત્રી ચારુતર વિદ્યામંડળ, વ.વિદ્યાનગર-૩૮૮૧૨૦
૬. માલિકનું નામ	: ડૉ. એસ.જી.પટેલ
રાજ્યાયતા	: ભારતીય
સરનામું	: માનદ મંત્રી ચારુતર વિદ્યામંડળ, વ.વિદ્યાનગર-૩૮૮૧૨૦

હું, એસ.જી.પટેલ, આથી જહેર કરું છું કે ઉપર
 આપેતી વિગતો મારી જાણ અને સમજ મુજબ બરાબર છે.

૫ માર્ચ ૨૦૨૪ ડૉ. એસ.જી.પટેલ
 માનદ મંત્રી, ચારુતર વિદ્યામંડળ

- * I never saw a wild thing sorry for itself.
- * No bird soars too high if he soars with his own wings.
- * Faith is the bird that feels the light when the dawn is still dark..
- * Hold fast to dreams die, life is a broken-winged bird that cannot fly...
- * Intelligence without ambition is a bird with out wings...

॥ સમીક્ષા લેખ ॥

પન્નાલાલ પટેલ કૃત 'વળામણા' લઘુ નવલક્થા

પ્રવીણભાઈ ભીખાભાઈ વજીર

નવલક્થાકાર, વાતાકાર, નાટ્યકાર એવા પદ્માલાલ નાનાલાલ પટેલનો જન્મ તા. ૭-૫-૧૯૧૨ ના રોજ વતન રાજ્યસ્થાન રાજ્યના ઠુંગરપુર જિલ્લાના માંડલી ગામે. અલ્યાસ ઈડરમાં અંગેજી ચાર ધોરણ સુધી. કૌંટુંબિક પરિસ્થિતિને લીધે અલ્યાસ છોડી એકાદ વર્ષ ઠુંગરપુર ને સાગવાડામાં દાડુના ભઢા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સહગૃહસ્થને ઘરે નોકરી. એ સહગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં ઓર્ડિલમેન અને પછી મીટર-રીડિંગ કરનાર. ૧૯૭૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષહના અધિવેશનના ઈડર શાળાના સહાધ્યાથી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્ય સર્જનનો પ્રારંભ. ચાર-પાંચ વર્ષ મુંબઈની અન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટક્થા લેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખનપ્રવૃત્તિ.

આવો, આવા ગુજરાતી સાહિત્ય જગતના શ્રેષ્ઠ સર્જક અને ૧૯૮૫ના વર્ષનો ભારતીય શાન્દુલી એવોઈ વિજેતા એવા પદ્માલાલ પટેલનો પરિચય મેળવીએ.

રાજ્યસ્થાનના ઠુંગરપુર જિલ્લાનું આ ગામ અને આસપાસના લીલી શોલા ધરાવતા ટેકરીઓના વિસ્તારમાં પદ્માલાલનું બાળપણ વીતું. પિતા નાનશાનું અવસાન થયું ત્યારે પન્નાલાલ બે વર્ષના હતા. આર્થિક અભાવો અને સામાજિક વિષમતા વચ્ચે પન્નાલાલ સાધુ જ્યંશંકરાનંદ અને પછી હિંમતનગરના મહારાજાંબુલરના આશ્રયે આઠ ધોરણ સુધી ભાડી શક્યા. શાળામાં ઉમાશંકર જોશી તેમના સહાધ્યાથી હતા. ઉમાશંકરને પન્નાલાલની મોકળાશભરી વર્તણૂક આકર્ષતી. કશી રોકટોક અનુભવ્યા વગર બધી

પરિસ્થિતિઓમાં પન્નાલાલ એક જતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા. તેમની 'વળામણા' કૃતિ વિશે જાણીએ.

'વળામણા' લઘુનવલમાં સંકુલ પાત્રચિત્રણ :
મનોરદા મુખી

સૂજ અને ધરતીના છોરું શબ્દોથી જાણીતા બનેલા પન્નાલાલ પટેલ જેમણે ગ્રામજીવનનું માનસ શબ્દો દ્વારા ચિનિત કરી વાસ્તવિકતાની ભૂમિ પર શબ્દોના અસ્તિત્વ સાથે કળાત્મક રીતે ખંડું કરી આપ્યું છે. ગ્રામ્યજીવનને આટલી નિકટતાથી વાર્ણવનાર અને સચ્ચાઈભર્યું સંવેદન પન્નાલાલ તેમની સર્જકતા દ્વારા સાહિત્યમાં પ્રસ્તુત કરે છે. તેમના પાત્રો આપણને ગ્રામ્યજીવનની નજીક લઈ જાય છે. પાત્રોમાં રહેલ ભાષા, પહેરવેશ, સંવાદો, તળપદા શબ્દો, ડિફ્રેગ્યોગો, કહેવતો કથાને વધુને વધુ સૌંદર્ય બક્ષે છે. પન્નાલાલ પટેલની કથાસાહિત્યમાં પ્રસિદ્ધ પામેલી ત્રણ નવલક્થાઓ 'વળામણા' (૧૯૪૦), 'મળેલા જીવન' (૧૯૪૧) અને 'માનવીની ભવાઈ' (૧૯૪૭). જે સાહિત્યપ્રિય વાચક સિવાય પણ અન્ય વાંચનપ્રિય વ્યક્તિને પોતાની સૌંદર્યશીલતાનું રસદર્શન કરાવ્યા વિના રહેતી નથી. પન્નાલાલ પટેલની વળામણાની રચના ૧૯૪૦ માં ગુજરાતી સાહિત્યમાં મળી આવે છે. ત્યારબાદ ૧૩ જેટલી આ લોકપ્રિય કૃતિની આવૃત્તિ થતી રહી છે. જે સર્જકની સર્જકતાને વધુને વધુ ઉજાગર કરે છે.

'વળામણા' કૃતિમાં રહેલ કેન્દ્રવર્તી પાત્ર મનોરદા મુખી છે. સમગ્ર લઘુનવલ મનોરદા પાત્રની સાથે સાથે જગતિ કરે છે. આમ, મનોરદાનું પાત્ર કથા સાથે ગતિશીલ અને પાત્રની ગતિશીલતા સાથે કથા વિકસતી જાય છે. કૃતિમાં પાત્રની નાટ્યાત્મકતા સંવાદોની કાર્યસૂજુ તેની બુદ્ધિની એરાણ પર ધારદાર થતી ઘટનાઓ અને પાત્રના મનોસંચલનોના દ્વારા પાત્રની સ્થિરમાંથી ગતિશીલ થતી કિયાને સજીકે રજૂ કરી છે.

લઘુનવલના આરંભથી અંત સુધી કાર્યક્રમ પાત્ર : મનોરદા મુખી :

લઘુનવલમાં સૌથી કાર્યક્રમ પાત્ર મનોરદા મુખી બને છે. જેમાં લેખકની પાત્ર નિરૂપણ કળા સુરેખ રીતે ગતિ કરતી જાય છે. અહીં મુખીપણા સાથે સંકળાયેલી કુટિલતા તેને લાલચમાં નાંબે છે. સજ્જક આ દ્વારા માણસ સ્વયં ખરાબ હોટો નથી, પરંતુ ક્યારેક ખોટા કામ કરતાં ખરાંખરીના સમયે મનુષ્ય પાછાં નીતિના રસ્તે વળામણાં કરે છે. એવી ગતિશીલતા દર્શાવવા માટે સજ્જક પોતાની દાણ અને સ્કૂલનો સમન્વય સાધીને આ લઘુનવલની રચના કરી છે. કથાના આરંભે સજ્જક આખા ગામની ખબર રાખનાર મનોરદા મુખી મોઢામાં મોડાં જમીને ઉઠયા અને હથ કોરા કરી રહ્યા છે. તેવામાં જ કોઈ માણસના પગરવનો અવાજ મનોરદાને સંભળાય છે. ‘એ તો હું મોત્યો, મનોરકાકા ! તમારું જરા કામ પડ્યું છે’ એવો અવાજ કાને પડે છે. અને મનોરદા ‘કુણ જાણે એને વળી શું કામ પડ્યું છે અત્યારે !’ એમ બબડે છે અને જવા નીકળે છે. અહીં લેખક મનોરદાનું બાધ્ય પાત્રચિત્રણ તેના પહેલવેશ દ્વારા રજૂ કરે છે. મનોરદાના પાતળિયા અંગનું ઘરનું છતાંય મજબૂત કાંકું અત્યારે વધારે સ્કૂર્ટિમાં આવી ગયું હોય તેમ લાગતું હતું. તેમણે ઓશાકી મુકેલું અંગરખું ફહેરી લીધું. ઘરમાં જઈને ખીટીએ ભરાયેલું સૂંધિયા જેવું ગોળ ફાળિયું માથે મૂક્યું અને કામળી પણ ઓઢી લીધી; એક હથમાં લાકડી અને બીજા હથ હુંકો લઈ નીકળ્યા. (પૃષ્ઠ-૭)

મનોરદા નીકળે છે અને તેમના કાન પર બે ચાર શાબ્દો પડે છે. ‘ગઈ ત્યાં જાય ના ! કાઢી મેલ, મારા જેવો ભૂંડો...’ (પૃષ્ઠ-૭). મનોરદાની ચતુરદાસી આટલાં જ વિધાનમાં આખી વાત સમજી જાય છે. કે સુથાર જ્ઞાતિના બહેચરની બહેન જમંકું તલાઈને ત્યાંથી પાછી આવી છે. અને આ તકનો લાભ લેતાં મનોરદા મોતીને બદલે બહેચરને ત્યાં જાય છે. અહીં પાત્રની પ્રસ્તુતિ ખૂબ જ નાટ્યાત્મક રીતે થાય છે.

અને સંવાદોની કળા પણ સુંદર રીતે યોજાઈ છે. વાતનો ગલ કઈ રીતે જાણી લેવો એ મનોરદા મુખી ખૂબ જ સારી રીતે જાણે છે અને કહે છે એક કે'વત છે કે, ‘અલ્યા તારી માં તો નાતરે ગઈ.’ પેલો કે’છે: ‘ધણું ખોટું થયું !’ પણ પાછી આવી ! પેલો કે’છે: ‘એ તો વળી એનાથી ખોટું-ધૂબી મરવા જેવું થયું !’ એના જેવી વાત છે. (પૃષ્ઠ-૮)

આ રીતે મનોરદા પોતાની ઘાક જમાવીને સાચી વાતની વેતરણમાં લાગી જાય છે અને કહે છે તમારા મનથી તો એમ છે કે કોઈ જાણતું નથી પણ એ... પેલો... તમારો વેરવાઈ તો ઘર વીરી લેવાની વેતરણમાં છે, સમજ્યા ને ? (પૃષ્ઠ-૮). મનોરદા આ રીતે કડકાઈભર્યા અવાજમાં બધી વાત જાણી લે છે અને બહેચરના ઘરની ફજેતી ન થાય એ માટે એને મદદર્યપ થવા કહે છે. કથામાં બીજી તરફ સુથાર જ્ઞાતિનો મોતી અને તેની માતા અંબાને બહેચર સાથે વેર છે. માટે તેની ફજેતી થાય એવી ઈરાહે ગામના મુખીને બોતાવ્યો હતો. મનોરદા અહીં પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને અંબાભાબી અને બીજા પાત્રો સાથે બહેચરના ઘરની જડતી લેવડાવે છે. પરંતુ ભાગીને આવેલી જમંકું હથ લાગતી નથી આ સંજોગોમાં મનોરદા સંપૂર્ણ અંબા અને મોતીના પક્ષે છે એમ દર્શાવવા માટે એ કહે છે ‘મૂળા ! તુ કર, બેચરિયાના પાછલે બારણો જઈને સંતાઈ રહે’, પેતી ક્યાંય છટકી ન જાય...’ (પૃષ્ઠ-૧૫)

એકદમ અજાણ્યા ભાવે બહેચરના ઘરની તપાસ થાય છે. ‘જરા દીવો સળગાવો ને બે ચાર બોયાંય લાવો’ આવા સમયે બહેચર કંઈ બોલતો નથી ત્યારે મનોરદાના મનમાં થાય છે કે બુદ્ધિનો બુઢો કંઈ પૂછતોય નથી. એટલે પણી ફરીથી ઘૂરકીને કહે છે. ‘મારી સામે શું તકી’યો છે ? હમણાં ખબર પડશો !’ એટલે બહેચરના મોઢામાં જીબ આવી હોય તેમ ‘વસવા ન પડતો હોય તો જુઓ, આ રહ્યું ઘર’ સમગ્ર નાટ્યાત્મકતા બાદ મનોરદા નિશ્વાસ નાંખતા હોય તેમ સાથે આવેલા પાત્ર વીરાને કહે છે કે ‘વીરા

! આ તો ઢીક છે કે ગામમાં કોઈ જાણતું નથી, ને આપણામાંથી કોઈ વાત કરે એવું નથી. નકર આ ઘાડ મારી આવ્યા એ જો કોઈ જાણે તો મારે તો આટલાં વર્ષે હેઠું ઘાલવા વખત આવે !' (પૃષ્ઠ-૧૬). આમ પાત્ર સ્વયં પોતાનો મોભો જળવીને અન્ય પાત્રોને પોતાની 'હા એ હા' કરાવી જાણે છે.

મનોરદા બધાથી છૂટા પડી ઘરે જાય છે પત્નીને આખી વાત કહે છે અને ઝમકુંડીને ઝ્યાંય શહેરમાં જઈ વેચી આવી સોનાની નળિયા કરવા એવી વેતરણમાં લાગી જાય છે. મહુડાના ઝડ નીચે બેઠેલી ઝમકું ને રાતના અંધારામાં ગામની દૂર મહાદેવના બાવાના મંદિરમાં મૂકી આવે છે. બાવાને પણ મનોરદા ક્ષાતિ અને સમાજની પરિસ્થિતિ વર્ણવી ઝમકુંને આશ્રિત તરીકે રાખવા માટે કહે છે. બીજુ બાજુ ગામમાં ત્રણ ચાર દિવસ ઝમકુંની આવવાની વાતો સમી જાય પઈ તેને બાવાના મંદિરમાંથી લઈ જઈ ઝાંક ઠેકાણે પાડવી એમ વિચારે છે. આ સંજ્ઞેગોમાં ઝમકુંની માતા વારંવાર દીકરીના સમાચાર પૂછવા આવે છે ત્યારે મનોરદાના કઠોર વચ્ચનો જાણે ખલનાયક તરીકે તેને ચિતરે છે. તે જમનાને સંભળાવે છે કે, 'ગોઝારિયા કૂવામાં....?' (પૃષ્ઠ-૩૨)

મે'રબાની કરીને હમણાં તમે ઘેર જશો ? કોઈ નહીં વે'માતું હોય તોથ...! (પૃષ્ઠ-૩૨)

પૂછતાં જરા લાજેય નથી આવતી ! એ કાળમુખીના સમાચાર પૂછતાં તમારી જીભ શું કરીને ઉપડે છે !' (પૃષ્ઠ-૩૨)

'મારા જેવી તો જો મા હોત તો અત્યાર લગી તો ક્યારનીય ગળે નખ દઈને મારી નાંખી હોત, હોવે !' (પૃષ્ઠ-૩૨)

'કહ્યું તો ખરું કે હજ જો ન નાહ્યા હો તો નાંહી નાંખજો; સમજ્યા હવે' (પૃષ્ઠ-૩૩)

'એના કરતાં તો પાણો વેંફારવો તો કે તમે ને અમે બધાય લુગડાં ધોય ખાત.'

'આમ લાડ લડાવી લડાવીને જ દીકરીને વે'તી મેલી'તી... (પૃષ્ઠ-૩૩)

'આટાટાટવી ફજેતી થતાય માને લાજ નથી પછી વળી દીકરીમાં તો ક્યાંથી જ હોય ?' (પૃષ્ઠ-૩૩)

ઉપરોક્ત સંવાદોમાં મનોરદાનો ગુસ્સો પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીનું સ્થાન અને લાલચી મુખીની કુટિલતા ઉપસતી જાય છે. ગામમાં ઝમકુંની વાત શાંત થતાં જ મનોરદા પોતાની મૃત પુત્રીના કપડાં લઈને ઝમકું પાસે જાય છે. ઝમકું એ કપડાં જોઈને સમજી જાય છે એ તેની માતાએ તો મોકલ્યા નથી જ. મનોરદા ઝમકુંને શહેરમાં ધરમશાળાની ઓરડીમાં રાખે છે. અહીં મનોરદાની પણ કુટિલ એવું પાત્ર ઉમેરાય છે અમરસિંહ. જેની સાથે મનોરદા ઝમકુંનો સોદો કરે છે. આ અરસામાં ઝમકુંની બાળસહજ નિર્દોષતા અને મનોરદાની પિતા તરીકિની છબી વિકસતી જાય છે. જેને સોનાના નળિયા કરવાની અભિલાષા હતી તેને ઝમકુંનું વાત્સલ્ય સ્પર્શો છે. ઝમકુંને વેચાવા આવેલો મનોરદા આખું શહેર ફેરવે છે. સોદો કર્યો પછી કોઈ એક ક્ષાણે મનોરદાને પોતાની મૃત પુત્રીનું સ્મરણ થતાં તે ખરાખરીના સમયે અનીતિથી નીતિ તરફ વળે છે. હવે મનોરદા ઝમકુંને પાછો ગામ લઈ આવે છે. પરંતુ ઝમકુંને કોઈ જીવતી નહીં મેલે એ વિચારે મનોરદા ફરીથી પોતાની બુદ્ધિનું તેજ અજમાવે છે. ઝમકુંને ગામના મહુડાના ઝડ નીચે બેસાડી પ્રથમ તો તેના ભાઈ બહેચરને ભાઈબહેનના સ્નેહની વાત સમજાવે છે. કે, ગાંડા...! બુનના તો લોકેને ઓરતાં હોય છે ઓરતાં ! (પૃષ્ઠ-૮૮) અને વધુ ઉમેરતાં કહે છે. ને તારી બુને વળી એવો તે શો ભારે ગુનો કરી નાંખ્યો છે ? તું કે'તો હોય તો તારી નાતમાં એક એકનો કાન જાતીને કહી દેખાયું કુણ કેટલામાં છે. આ રીતે મનોરદા પોતાની ચાતુરીભરી સૂક્ષ્મથી જે અંબા બહેચરની ફજેતી કરવાની હતી તેના દીકરા મોતી સાથે જ લભની વાતને ગળે ઉતારી દે છે. પહેલાં તો અંબા આ સાથે સંમત થતી

નથી. પરંતુ મનોરદા વાતની રજૂઆત સ્વીક અને વંગથી કરે છે. અને કહે છે કે હું શોધવા નીકળું તો જમકું માટે ઘણાય મળી રહે પણ આ તો તમારે કામની પંચાત મટે માટે કહું છું. જમકુંના પક્ષે બોલતા હોય તેમ મનોરદા કહે છે કે બિચારીને સાસરી સારી ન મળી ને પિથરમાંથી ભાબીના મેળાં એમાં વળી તલાટીનાં બે પ્રેમભર્યા શબ્દોમાં ભોળવાઈ ગઈ. અને આવું પગાંનું ભરી બેઠી. પણ છે તો ડાહી એટલે તરત જ અંબા કબૂલ કરતી હોય તેમ કહે છે કે ‘હું ક્યાં અને નથી ઓળખતી ? આમ તો મુઈ દુશ્મનનેય વાતી લાગે એવી છે.’ (પૃષ્ઠ-૧૦૨)

આમ, રાતોરાત જમકું અને મોતીના લભ થાય છે. પરંતુ હવે મનોરદા સામે એક મોટો પ્રક્રષ શરૂ થાય છે કે સુથાર જ્ઞાતિના રિવાજો અને સામાજિક વાતાવરણ આખી સુથાર જ્ઞાતિ અને બીજી તરફ મનોરદા અને તેની પટલાઈ. પંચ લેગું થાય છે અને મનોરદા કહે છે કે આ જમકુંને હું સમયસર ન લઈ આવ્યો હોત તો કેક મુસલમાનના ઘરે જઈને બેઠી હોત અને આખા ગામની ઈજ્ઝત જીત અને ઘર્મ વટલાત એ બીજું અને બિચારા મોતીએ તો એને રાખીને સુથાર જ્ઞાતિની ઈજ્ઝત રાખી છે. એ બિચારા ગરીબને શું કામ નાત બહાર મુકી છો ? જે કંઈ ખર્ચ થાય એમાં પૂર્ણ કરેને. વધુમાં તે કહે છે કે આમાં ભૂલ તો જમકુંની છે તો એને સજી કરો અને પંચ એવો નિર્ણય લે છે કે જમકુંને મોઢામાં તરણું લઈને નાતના બધા સામે માફી મંગાવવી. આ વાતને પણ મનોરદા ખૂબ જ ચતુરાઈપૂર્વક પ્રથમ તો સ્વીકારી લે છે. પછી પંચના પાંચ આગેવાનોને કહે છે કે “માધા, સુથાર, આ ઠીક નથી થતું હોય ! એમાં નથી તો તમારા કૂળની આબરુ વધતી કે નથી તમારા પંચની વધતી !” (પૃષ્ઠ-૧૦૮) એમ કહીને જમકુંને સજીમાંથી ઉગારવાનો પ્રયત્ન કરતાં વાતની નવી ઝાળ રહે છે. અને કહે છે “હજું કોઈ મરદ માણસ પાસે લેવડાવીએ તોથ એક વાત છે પણ બૈરી પાંહે ? મને તો આ નથી ગમતું !” (પૃષ્ઠ-૧૧૮) વળી એમાં ઉમેરતા હોય એમ

કહે છે “કાળા મટીને ઘોળાં આવ્યા પણ આવી શિક્ષા તો મીં ક્યાર્થ દુનિયામાંથી નથી સાંભળી !” (પૃષ્ઠ-૧૧૬)

આ રીતે કથામાં મનોરદાની કુશાગ્ર બુદ્ધિ તેને ખલનાયક બનાવે છે અને કથાને અંતે નાયક તરરીક નિર્દ્દિપિત કરી જાય છે મનોરદાના હૃદયનું પરિશર્વતન. પોતાની મૃત પુત્રી નાથીને સમરિત કરતાં જમકું ઉપર વાત્સલ્યની ધારા વહે છે. દલાલ બનીને ગયેલો મનોરદા પિતૃહૃદય દ્વારા પોતાનાં વળામળાં કરે છે. કથાને અંતે તો મનોરદા પોતાના ઘરેથી જમકુંને વળાવે છે. એક તરફ જમકુંની વિદ્ધાય અને બીજા ખૂણામાં મનોરદાની આંખોમાંથી આંસુની એકઘારી સેર નિરાતે વહીને ખોટા કાર્યનું પ્રાયશિત અને સાચા કામની નિરાંત અનુભવે છે. આ મંગલ ઉક્તલવાળી નવલના અંતે સમગ્ર કૃતિને દીર્ઘજીવી બનાવી જાય છે.

સમગ લધુનવલનું સુંદર અંગ સર્જકનું ભાષા-પ્રભુત્વ છે. કૃતિમાં કહેવતો, રૂઢિપ્રથોગો, તળપદા શબ્દોની ભરમાર કળાકીય રીતે રચાઈને વાચકને વધુને વધુ ગ્રામ્યજીવન તરફ લઈ જાય છે. ગ્રામ્યપ્રદેશમાં પણ આવા ખલનાયક પાત્રો અને તેમના મુખે બોલાયેલી ભાષા જાણો સહજ સરી પડતાં શબ્દો ભાવકને વધુને વધુ આકર્ષિત કરતી રહે છે.

(પન્નાલાલ પટેલનું અવસાન તા.૬ અગ્રિત ૧૯૮૮ના રોજ થિયું.)

સંદર્ભગ્રંથો :

1. પટેલ પન્નાલાલ-વળામળાં, સાધના પ્રકાશન-અમદાવાદ, પુનર્મુદ્રાણ ૨૦૦૫
2. ચૌધરી રધુવીર, પન્નાલાલ પટેલ સાહિત્ય અકાદમી, ન્યુ હિલ્સી, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૩
3. ચૌધરી રધુવીર અને દવે રમેશ, પન્નાલાલનું પ્રદાન, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ પહેલી આવૃત્તિ, ૧૯૯૫.

રામનગર સોસાયટી, રેફરલ હોસ્પિટલ પાછળ,
મુ.પો.લાખાણી, તા. લાખાણી, જિ.બનાસકાંદા
પીન-૩૮૫૪૮૧, (મો) ૯૪૨૭૫૧૨૧૬૧

॥ સામાજિક ॥

ગૌ-સેવા પરમો ધર્મ:

દર્શક કે. પરમાર

ગાય સેવા પરમોધર્મ: જાણો કે સનાતનમાં ગાયને માતા કહેવામાં આવે છે અને શા માટે ભારતીય ગાયને વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારતીય ગાયો, કહેવાતી વિદેશી ગાયોની જેમ, જંગલોમાં લાંબા સમય સુધી હિંસક પ્રાણીઓ તરફિક રખડ્યા પછી ઘરોમાં ઉછેરવામાં આવતી નથી. ભારતીય ગાયોની વિરોધતાઓ તેમના ગળાનો ધાબળો (ગરદનની નીચેનો ભાગ), પીઠની ખૂંધ, પહોળું કપાળ, સુંદર આંખો અને મોટા વળંકવાળા શિંગડા છે. ભારતીય પશુઓની કેટલીક જાતિઓ ગીર, થરપારકર, સાહિવાલ, લાલ સિંધી વગેરે છે.

૧૯૪૦ માં ભાવનગર રાજ્યના મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ દ્વારા બ્રાહ્મિલને ૧૮ ગીર ગાયો આપવામાં આવી હતી. આ ગીર ગાયે બ્રાહ્મિલમાં શૈતકાંતિ લાવી હતી. જે બ્રાહ્મિલના પશુધનના ઈતિહાસમાં એક પ્રતીક અને સફળ ઉદ્ઘોગ સાહિસિક છે. આ જાતિ તેના ડાઉન શિંગડા અને લાલ-સ્ફેદ કોટ માટે પ્રભ્યાત છે. ભારતમાં પૂજવામાં આવતા સૌથી લોકપ્રિય હિંદુ દેવતાઓમાંના એકના નામ પરથી લેટમાં આપેલા આખલાનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું હતું. બ્રાહ્મિલમાં શૈત કાંતિ લાવનાર ગીર ગાય વર્ષોથી વધુ દૂધ આપતી જાતિ બની છે અને ભારે હવામાન અને ઉષ્ણિકટિબંધીય વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતાને કારણે દક્ષિણ અમેરિકાના દેશોમાં ખૂબ લોકપ્રિય છે. દેશના અર્થતંત્રમાં ગીરની ભૂમિકાની માન્યતામાં, તે બ્રાહ્મિલના સિક્કાઓ પર સ્થાન મેળવે છે. અને તેના તેરી ઉદ્ઘોગમાં મહારાજ કૃષ્ણ- કુમારસિંહજી ભાવસિંહજીના યોગદાનને માન્યતા આપે છે; દેશે તેના સંસદ ભવન પાસે સ્વર્ગસ્થ શાસકની પ્રતિમા ઊભી કરી છે. સમય જતા, આ જાતિ હવે સમગ્ર અમેરિકન ખંડમાં ફેલાઈ ગઈ છે અને

ગીર ગાય એ ભારતમાં ઉદ્ઘબવેલી પશુઓનો મુખ્ય ઝેબુ જાતિઓમાંની એક છે. પશુધનની હરાળું દુનિયામાં એક સીમાચિહ્નદ્વારા ઘટનામાં વિચારિના- ૧૬ એફઆઈવી મારા ઈમોવીસ નામની નેલોર ગાયે અત્યાર સુધીની સૌથી મૌંધી ગાય બનીને ઈતિહાસ રચી દીધો છે, જેણે આશ્રમજનક ૪.૮ મિલિયન USD (ભારતીય ડિપિયામાં ૪૦ કરોડ જેટલા) મેળવ્યા છે. આ રેકૉર્ડ-બ્રેકિંગ વેચાણ પશુધન ઉદ્ઘોગમાં શ્રેષ્ઠ આનુવંશિક ગુણોના મહત્વને માત્ર હાઈલાઇટ કરતું નથી પરંતુ અસાધારણ પશુધન આનુવંશિકતા પર મૂકવામાં આવતા વધતા મૂલ્યને પણ રેખાકિત કરે છે.

કરનાલની નેશનલ બ્યુરો ઓફ જિનેટિક રિસોર્સિસ (NBAGR) સંસ્થાએ ભારતીય ગાયો પર એક અભ્યાસ હાથ ધર્યો અને જાણવા મળ્યું કે તેમની પાસે અધતન A-2 એલીલ જનીન છે. જે તેમને સ્વસ્થ દૂધ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ ૪૦નીનાં આવૃત્તિ ભારતીય જાતિઓમાં ૧૦૦ ટકા સુધી જોવા મળે છે. જ્યારે વિદેશી જાતિઓમાં તે ૬૦ ટકાથી ઓછી છે.

ભારતીય ગાયોમાં સૂર્યકૃતુ નાડી હોય છે. ગાયો તેમના લાંબા શિંગડાઓ દ્વારા આ સૂર્યકૃતુ નાડીમાં સૂર્યના કિરણોનું પ્રસારણ કરે છે. આ કારણે, સૂર્યકૃતુ નાડી સુવર્ણ આધાર ઉત્પન્ન કરે છે, જેનો મોટો ભાગ દૂધમાં આવે છે. અને ગૌમૂરમાં થોડો ભાગ આવે છે. ભારતીય ગાયના દૂધમાં ઓમેગા-૬ ફેરી એસિડ હોય છે, જે કેન્સર નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદેશી ઓલાહની ગાયોના દૂધમાં તેનો કોઈ પતો નથી. ભારતીય ગાયના દૂધમાં અસંતુષ્ટ ચરબી હોય છે, જે ધમનીઓમાં ચરબી જમા થતી અટકાવે છે. અને હદ્યને પણ મજબૂત બનાવે છે.

જે ભારતીય ગાય ચરતી વખતે કોઈ ઝેરી પદાર્થ ખાય છે, તો અન્ય પ્રાણીઓની જેમ તે ઝેરી પદાર્થ દૂધમાં ભળતો નથી. વિશ્વમાં ભારતીય ગાય એકમાત્ર અલું પ્રાણી છે જેનું મળ અને મૂત્ર દવા અને

યજ્ઞ, પૂજા વગરેમાં વપરાય છે. ગાયનું છાણ ન્યુક્લિયર રેડિયેશનથી બચાવવા માટે ઉપયોગી છે. ભારતીય ગાયના છાણ અને ગૌમૂરમાં કિરણોત્સર્જિતાને શોખી લેવાની મિલકત છે. ભારતીય ગાયનું પંચગવ્ય નજીકના ભવિષ્યમાં એક મોટી જૈવ-ઔષધી બનવાની આરે છે. અમેરિકાએ પેટન્ટ આપીને સ્વીકાર્યું છે કે ગૌમૂર કેન્સરને નિયંત્રિત કરવામાં મદદદ્ધપ છે.

સંતોષે તો ત્યાં સુધી કહ્યું છે કે “જો કોઈ બીમાર વ્યક્તિ હોય અને ડોક્ટર કહે કે ‘તે બચશે નહિં’, તો જો તે વ્યક્તિ પોતાના હાથે ગાયને કંઈક ખવડાવશે અને ગાયની પીઠ પર હાથ ફેરવશે, તો મોઝાં ગાયના હાથમાં સુખની અનુભૂતિ થશે. તે આંગળીના ટેરવાથી તેના શરીરમાં પ્રવેશ કરશે, રોગપ્રતિકારક શક્તિ વધશે અને માણસ સ્વસ્થ બનશો, એ થી ૧૨ મહિના લાગે છે પણ અસાધ્ય રોગો પણ મટાડી શકાય છે. ગાયના સુખથી.”

દરરોજ અડધો કલાક ભારતીય ગાયની પીઠ પર, ગલમાળા પર હાથ ઘસવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. ગાયના છાણને શરીર પર ઘસવાથી અને સ્નાન કરવાથી ત્વચાના ઘણા રોગો દૂર થાય છે. શુદ્ધતા અને સ્વાસ્થ્યની દરિયે ગાય સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ, ભારતીય ગાયમાં ઘણી અદ્ભુત લાક્ષણિકતાઓ છે. એવા શ્રીમંત લોકો છે જેઓ ભારતીય ગાયમાંથી દૂધ, દૂધની બનાવટો વગરે મેળવે છે અને જેઓ તેમની પ્રશંસા કરે છે.

ભારતમાં પ્રાચીન કાળથી ગાયની પૂજા કરવામાં આવે છે કારણ કે ગાયમાં ૩૩ કોટિ દેવતાઓનો વાસ માનવામાં આવે છે, તેથી ગાયને માતાનો દરજ્ઞો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે જો કોઈ બાળક જન્મે છે અને કોઈ કારણસર તેની માતાનું મૃત્યુ થાય છે, તો બાળકને ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે. જો દૂધ પીવડાવવામાં આવે તો તે જીવી શકે છે.

ગાય માતા ભારતની કરોડરજ્ઞ છે. જે દરેકને સ્વસ્થ અને સુખી જીવન જીવવામાં મદદ કરે છે. દરેક

વ્યક્તિએ જીવનભર ગાય માતાની રક્ષા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. ગાયોએ અનેક રીતે વર્ષોથી માનવ જીવનમાં મદદ કરી છે. ગાય અનેક વર્ષોથી આપણા જીવનને સ્વસ્થ બનાવવાનું કારણ બની છે. આપણે બધા આપણા જીવનમાં તેના મહત્વને જાણીએ છીએ ને આથી હંમેશા તેનું સંન્માન કરવું જોઈએ. માતા ગાયની ઉપયોગિતા અને તેની હત્યા થઈ રહી છે તે હક્કિકતને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે કે સૌઅે સાથે આવીને તન, મન અને ધનથી તેને રાષ્ટ્ર માતાનો દરજ્ઞો આપીને તેનું રક્ષણ કરવું જોઈએ.

સરકાર ગાયોને અન્યાયથી બચાવવા માટે પણ ઘણાં પગલાં લઈ રહી છે. કાયદાકીય જોગવાઈ પણ કરેલી છે જેથી ગૌહત્યા કરી શકાય નહીં. તેમની સુરક્ષા માટે લોકો ગઠબંધનમાં સંગઠનો બનાવી આગળ આવી રહ્યા છે. તેઓ ગાય સાથે કોઈપણ પ્રકારનું અયોધ્ય વર્તન કરવાનું પસંદ કરતા નથી. ઇતાં પણ ગાયોની કોઈક રીતે કંતલ ખાનામાં કંતલ થતી જોવા મળે છે જે ખરેખર ગેરકાયદેસર બાબત છે. અને ધાર્મિક રીતે પણ ઠેસ પહોંચાડનાર છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે ગૌપાલકો ગાયોને ધૂટી મૂકી દે છે અને તે કયારેક અક્સમાતનું કારણ પણ બને છે અને ગંદકી પણ ફેલાવે છે અને આવી ગાયો ખોરાકમાં પ્લાસ્ટિક તથા નકામો કચરો આરોગે છે જે તેના સ્વાસ્થ્ય માટે તથા તેનું દૂધ પીતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ગૌપાલકોએ પણ પોતાની મર્યાદાઓ જાળવવી જોઈએ અને ગાયોનું યોગ્ય રહેઠાણ તથા ખોરાકની વ્યવસ્થા કરવી તેમની ફરજના ભાગડ્ય હોય તે કરવા તત્પરતા દાખવી જોઈએ. ગાયોના રક્ષણ માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને ગૌધનના રક્ષણ માટે આપણે અવાજ બનવું જોઈએ.

બી. એન્ડ બી ઈન્સિટ્ટ્યુટ ઓફ ટેકનોલોજી,
વદ્વાલ વિદ્યાનગર, (મો) ૯૯૯૯૧૦૫૦૦૩

જૂન-૨૦૨૪ | વિ-વિદ્યાનગર ૬૩૨ | ૨૫

॥ શિક્ષણ ॥

વિશ્વ કલ્યાણને માટે ભારતીય શિક્ષણ

મૂ.કે.મુકુલ કાનિટકર અનુવાદક : મહેન્દ્ર નાઈ

સભાગૃહમાં ઉપસ્થિત માતૃશક્તિ અને ભાઈઓ. વાસ્તવમાં હું આજે અહીં આપની વચ્ચે આવ્યો હતો. તમારી સાથે ચર્ચા કરવા અને તમારી વાતો સાંભળવા માટે. જેમકે શરૂઆતમાં મનોજ દિક્ષિતજી (કુલપતિ, રામભનોહર લોહિયા અવધ વિશ્વ. વિદ્યાલય)એ ભારતીય શિક્ષણ મંડળનો પરિચય આપતા જણાવ્યું કે આ સંગઠન શિક્ષણમાં ભારતીયતાના તત્ત્વોને પુનઃપ્રતિષ્ઠિત કરવાનું કાર્ય કરી રહ્યું છે અને અનો સૌથી મહત્વપૂર્ણ પક્ષ જે છે, અને ડૉ. કૃષ્ણગોપાલજીએ આપણી સમક્ષ અત્યંત વિસ્તૃત રીતે પ્રસ્તુત કર્યો છે. શિક્ષણમાં ભારતીયતાની ચર્ચા કરતી વખતે સામાન્ય રીતે એ ચર્ચા પાઠ્યકક્ષ (પાઠ્યવસ્તુ) ની તરફ ફંટાઈ જય છે અને પાઠ્યકક્ષમાં ભારતીયતા આવી જય એ વાતને લઈને પ્રયત્નો થાય છે. એ મહત્વનું છે કે આપણા શિક્ષણની પાઠ્યવસ્તુ ભારતીય દશ્કોણથી ભણાવવામાં આવે. આજે જ્યાં વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) હોય, મહાવિદ્યાલય હોય કે પછી પ્રાથમિક શિક્ષણ હોય આપણે જો આપણા પાઠ્યકક્ષના પુસ્તકોને વાંચીએ છીએ તો એવું લાગતું જ નથી કે આપણે ભારતનાં દશ્કોણથી ભારતના સંતાનોને ભણાવી રહ્યા છીએ.

બાલમંડિર, કે.જી.માં ભણાવવાળા બાળકોનાં પુસ્તકો જોઈએ તો એમાં જે બાળકો માટેના ચિત્ર હોય છે તે પણ ભારતીય નથી હોતા. એ ચિત્ર પણ વિદેશી હોય છે. ગાયનું ચિત્ર હોય તો તે દેશી ગાય નથી હોતી, તે ઈંગેન્ડની ગાય હોય છે. તો આ વિષય મહત્વપૂર્ણ છે જ, અને એટલે જ જ્યારે ભારતીયતાની વાત થાય છે ત્યારે આ વાત પર ચર્ચા થવી સ્વાભાવિક છે. ઉચ્ચશિક્ષણમાં પણ વિષયોની આ જ સ્થિતિ છે. ભારતનું વિજ્ઞાન, ભારતના વિચાર, ભારતના વૈજ્ઞાનિકોની વાતો ભારતમાં ભણાવવામાં

નથી આવતી. ફાન્સમાં ભણાવવાળા આઈમા ધોરણના વિદ્યાર્થીને ગણિતનો ઇતિહાસ જ્યોર્જ ઈન્ફા-ઇતિહાસકાર લિભિત જ ભણાવવામાં આવે છે. ફાન્સના આઈમા ધોરણના વિદ્યાર્થી પણ એ જાણે છે કે આધુનિક ગણિત જે વિશ્વમાં આજે ચાલી રહ્યું છે એમાંથી ૮૦ ટકા ભારતે વિશ્વને આવ્યું છે. આ વાત ફાન્સમાં ભણાવવામાં આવે છે અને ભારતમાં ભણાવવામાં નથી આવતી. ભારતનો એન્જિનિયરિંગ પાસ કરેલ વિદ્યાર્થી એવું સમજે છે કે જે બીજગણિત (Algebra) માં $(a+b)^2$, $(a-b)^2$ ની સાથે મેં જે લડાઈ કરી હતી. એ બધું જ તો પશ્ચિમથી આપણી પાસે આવ્યું છે. ફાન્સના વિદ્યાર્થીને ભણાવવામાં આવે છે કે બીજગણિત ભારતથી વિદેશમાં ગણું હતું. ભારતના કોઈ ગણિતજ્ઞએ દુનિયાને શીખવ્યું હતું પછી ભલે એ અંકગણિત હોય, કે પછી ભૂમિતિ હોય, કે પછી ત્રિકોણમિતિ હોય, કે પછી ડેલ્ક્યુલસ હોય. આ ફાન્સના આઈમા ધોરણના વિદ્યાર્થીને ભણાવાય છે, ભારતમાં આ ભણાવાતું નથી. માટે ભારતનો વિદ્યાર્થી આપણાં રાષ્ટ્રને પ્રતિ ગૌરવ લઈ ઊભો હોય એવું આપણને જેવા નથી મળતું. જ્યાં એક વિદ્યાર્થી ઉપર ૪૦-૪૦ લાખ રૂપિયા સરકાર ખર્ચ કરે છે. તે આઈ.આઈ.ટી.ના સર્વોચ્ચ પ્રતિભાશાળી ભારતના વ્યક્તિઓ પાસ થયા બાદ ભારતમાં રહેવા નથી ઈચ્છાતી. પ્રથમ તક મળતા જ તે વિદેશ ચાલ્યા જય છે. માનનીય પં. મહનમોહન માલવીયાજીના વિશે ડૉ. કૃષ્ણગોપાલજી ઘણી વખત કહે છે કે બનારસ વિશ્વવિદ્યાલયના સર્વોચ્ચ વિદ્યાર્થીને તે ત્યાં જ શિક્ષક બને એના માટેના પ્રયત્નો તે વિશેષ કરતા હતા. આજે આપણી આઈ.આઈ.ટી.માં ભણાવનાર શિક્ષક, એક તો એમાં ૪૦ ટકા જગાઓ તો ખાલી છે, બીજી ભરેલી ૧૦ ટકા છે એમાંથી માત્ર ૩૮ ટકા શિક્ષકો પોતે આઈ.આઈ.ટી.માં ભણેલા છે. આઈ.આઈ.ટી.માં ભણાવનાર શિક્ષક આઈ.આઈ.ટી.માં ભણેલ નથી. કેમકે ત્યાં ભણેલ વિદ્યાર્થી આઈ.આઈ.ટી.માં શિક્ષક થવા નથી ઈચ્છાતો.

જ્યારે શિક્ષણમાં ભારતીયતાનો વિષય આવે છે તો એમાં સૌથી મહત્વપૂર્ણ અંશ એ છે જેના પર હમણાં હો. ફૃશગોપાલજીએ વાત કરી. શિક્ષકનું જે સન્માન અને આદર ભારતમાં છે એની જ્યાં સુધી પુનઃપ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી સર્વોચ્ચ વિદ્યાર્થી ફરીથી શિક્ષક નહીં બની શકે. તેને લીધે ભારતીય શિક્ષણ મંડળના કાર્યને કોઈને કોઈ એક વાક્યમાં કહેવાનું કહે છે ત્યાં હું કહું છું કે 'શિક્ષકની, ગુરુની, આચાર્યની ખોવાઈ ગયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રતિષ્ઠા કરવાને લીધે ભારતીય શિક્ષણ મંડળ કાર્ય કરે છે.' અને એ જ આજના પરિસંવાહનો ઉદ્દેશ્ય છે. અહીં શિક્ષક તેમજ બી.એડ. અને પી.ટી.સી.ના વિદ્યાર્થી બેઠા છે જે આગળ જઈ શિક્ષક બનવાના છે. અમારા લીધે અત્યંત સન્માનનીય અને આદરજીય એવા લોકો અહીં ઉપરિથિત છે એવા આદરની સાથે અમે તમને અહીં બોલાવ્યા છે. એટલા માટે હું તમને સાંભળવા માટે અહીં આવ્યો છું.

એક બીજો મહત્વપૂર્ણ વિષય જેના પર ચર્ચા કરવી આવશ્યક છે તે છે વિધિ (પદ્ધતિ) નો. આ વિષય છે મેથોડોલોજીનો વિષય. કઈ પદ્ધતિથી અધ્યયન થાય, શિક્ષણ નહિ. આ પણ ભારતની વિશેષતા છે. આજથી બે વર્ષ પહેલાં ભારતીય શિક્ષણ મંડળે ગુરુકુળ પ્રકલ્પનો પ્રારંભ કર્યો. દેશભરમાં સંચાલિત ગુરુકુળોનું સંકલન કરવાનો પ્રારંભ કર્યો. આજથી ૨૦ વર્ષ પહેલાં બેંગલોરમાં ભારતીય શિક્ષક મંડળે પ્રથમ ગુરુકુળ પ્રારંભ કર્યું હતું. આજે ત્રણ ગુરુકુળ છે. અને ભારતીય શિક્ષણ મંડળની પ્રેરણાથી સંચાલિત ૧૦ થી ૧૨ ગુરુકુળ આજે ચાલી રહ્યા છે. જ્યારે ગુરુકુળો વિશે ચર્ચા થાય છે. ત્યારે વિષય નીકળે છે કે ગુરુકુળમાં હોય છે શું? અમે કહીએ છીએ ગુરુકુળમાં એ બધું જ હોય છે જે બાકી બધી વિદ્યાલયોમાં હોય છે. વિષય અલગ નથી હોતા. અમારા ગુરુકુળના બાળકો વેદધાઠ જેટલા સારા કરે છે તેટલી જ સારી રીતે કોમ્પ્યુટર જાણે છે, તેટલું જ સારું ભૌતિક વિજ્ઞાન, ભૂગોળ, વનસ્પતિ વિજ્ઞાન (બોટની)

જાણે છે. ક્યાંક તેનાથી વધારે જાણે છે. એનું કારણ એ છે કે એમને ભાણવવાની પદ્ધતિ ભારતીય છે. તે માહિતી પર આધારિત નથી, તે ગુગલ પર મળવવાળી નથી. તે જીવન તત્ત્વ છે. જે ગુરુ દ્વારા શિષ્યમાં પરિવર્તિત થાય છે. તે પદ્ધતિ અલ્યાસની પદ્ધતિ છે, ભાણવવાની પદ્ધતિ નથી. ભણાવવું એ તો માત્ર અલ્યાસને પ્રોત્સાહન આપવા માટે છે. તેથી જ માનવતાના તમામ તત્ત્વોનો જવાબ ભારતીય શિક્ષણમાં મળે છે. તેથી જ આજનો વિષય વિશ્વકર્માણ માટે ભારતીય શિક્ષણ છે. કારણ કે આજે વિશ્વની માનવ વસ્તી એકકી વિકાસની તમામ આડઅસરો (સાઈટ ઇફિક્ટ)ને ભોગવી રહી છે. મન અને હૃદય વરચે સંઘર્ષ ઊભો થયો છે. તમામ શિક્ષણ મગજ પર આધારિત બન્યું છે. હૃદયના ઊંડાણના અભાવે સમગ્ર વિશ્વ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. માણસ અંદરથી તૂટી રહ્યો છે.

આજે સંશોધન માટે સૌથી વધુ પૈસા કઈ બીમારી પર ખર્ચ થાય છે? તમને જાણીને આશ્રય થશે કે તે બીમારી એઈસ અથવા કેન્સર નથી, એના ઉપર તો સંશોધન ચાલી રહ્યું છે. પણ ચુરોપ અને અમેરિકામાં જે બીમારી પર સૌથી વધુ ખર્ચ થાય છે તે બીમારી છે. અનિદ્રા (અપૂર્તી ઊંઘ).

રીડર્સ ડાઇજેસ્ટનો એક રિપોર્ટ વાંચ્યો હતો. પ્રત્યેક અમેરિકાવાસીનું એમાંથી સરેરાશ એવરેજ કાઢ્યું એમાંથી અમેરિકામાં વેચાતી ઊંઘની ગોળીઓ અને એને અમેરિકાની જનસંખ્યા પોષ્યુલેશનથી ભાગી ડીવાઈડ જોયું. અને ઊંઘની ગોળીઓનું સેવન શોધ્યું. તે કહે છે કે અમેરિકાને ૧૮ ઊંઘની ગોળીઓ ખાદ્ય વિના ઊંઘ નથી આવતી. તેથી જે યુવાનો સાથે વાત કરતો હોઉં અને યુવાનો કહે છે કે ભારતે આપણને શું આપ્યું, ત્યારે હું યુવાનોને કહું છું કે ભારતે તમને શાંતિપૂર્ણ ઊંઘ આપી છે. દુનિયામાં તો ઊંઘવા માટે દબાવો ખાવી પડે છે. ભારતમાં તો કોઈપણ વ્યક્તિ બસમાં સૂઈ જાય છે, ભારતીય રેલવેના જનરલ ડબ્લ્યુમાં ઊભા રહેવાની જગ્યા નથી હોતી, હાથ

ટિગાડેલ હોય એવી સ્થિતિમાં પણ માણસ તમને ઉંઘતા જોવા મળે. આ શાંતિપૂર્ણ ઉંઘ ભારતીય સંસ્કૃતિની ભેટ છે. આજે આપણા શિક્ષણમાંથી તે હવ્યની શાંતિ સમાં થઈ છે, અશાંતિ આવી છે. કેમકે ફરી એકવાર આપણી પદ્ધતિ ફક્તને ફક્ત માત્ર જાણકારી પર આધારિત થઈ ગઈ છે. આર.ટી.ઈ. અંતર્ગતની પરીક્ષાઓ આઠમા ધોરણ સુધીમાં સમાં કરી દેવામાં આવી. મોટો હોબાળો થયો. ૨૪ રાજ્યના શિક્ષણમંત્રીઓ એકઢા થયા અને રજૂઆત કરી અને કહાય આ લોકસભા સત્રમાં આર.ટી.ઈ.માં સુધારો કરવામાં આવ્યો અને હવે પરીક્ષા લેવામાં આવશે. પાંચમાંથી, આઠમાં લેવાશે એવું પરિવર્તન થયું છે. મહિષી અરવિંદ કહે છે. માત્ર માહિતીના આધારે પરીક્ષાઓ લેવી એ શિક્ષણનો નાશ કરવાનો એક માર્ગ છે. તમામ શિક્ષણની પવિત્રતા ખતમ થઈ ગઈ.

એક બાળકને તમે તરણ (તરવું) પર નિબંધ લખવાનું કહો તો એ ખૂબ જ સુંદર માહિતી લઈ નિબંધ લખી આપે છે. તરણનો ઇતિહાસ રજૂ કરી આપે છે, માનવ ઇતિહાસમાં પહેલો તરવૈયો કોણ હતો. એ બધું જ જણાવી હો છે. તરણનું વિજ્ઞાન જણાવી હો છે. એનું ભૌતિક વિજ્ઞાન (ફિઝિક્સ) જણાવી કહે છે કે કેવી રીતે હાથ નીચે મારવાથી ઉત્સાહ બળ ઉપર લાગે છે અને આમ શુદ્ધ નિબંધ લખી આપે છે. તમારામાંનો કોઈ શિક્ષક એનો નિબંધ વાંચશે તો અને તરણમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ આપી દેશે. પણ, એને તળાવના પાણીમાં નાખી જુઓ, જ્યાં અનુભૂતિ નથી ત્યાં જ્ઞાન કેવી રીતે હોઈ શકે.

એટલે જ જ્યારે શિક્ષણમાં ભારતીયતાની વાત કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે અનુભૂતિ આધારિત શિક્ષણ આપણી એન્જિનિયરિંગ કોલેજોમાં કરારે આવશે. કરારે આપણા એન્જિનિયરિંગ કોલેજ હાથથી કામ કરવાવાળા શિક્ષણ પર આધારિત થશે. આજકાલ તેને હેન્ડસ ઓફ એજિયુકેશન કહે છે. પોતાની જાતે (હાથથી) કામ નહિ કરે. આપણા

ઓટોમોબાઇલ એન્જિનિયર ચાર વર્ષમાં કારના, સ્ક્રોટરના અને મોટા મોટા વિમાનના ડિઝાઇન ભણી લે છે, એમાં પરીક્ષા આપી ગોલ્ડમેડલ મેળવી લે છે, ખૂબ જ સુંદર ચિત્ર (ડિઝાઇન) બનાવે છે પણ જ્યારે પોતાની કાર ખરાબ થાય છે તે સમયે બોનેટ ખોલતા પણ નથી આવડતું. કેમકે એની પાસે જ્ઞાન નથી માત્ર જાણકારી (માહિતી) છે. તેણે (ઓટોમોબાઇલ એન્જિનિયર) તેની કાર એ માણસ પાસે લઈ જવી પડે છે. જેણે આઠમા ધોરણ પછી ભાણવાનું છોડી દીધું હોય અને મિકેનિકની જોડે રહી શીખ્યો હોય તે તમારી કારનો અવાજ સાંભળી કહી હો છે કે કારમાં શું ગરબદ છે. જેની પાસે જ્ઞાન છે તેની પાસે સાર્ટિફિકેટ છે તેની પાસે જ્ઞાન નથી. આ પદ્ધતિની સમસ્યા છે, મેથોડોલોજીની સમસ્યા છે વિષયવસ્તુ (કન્ટેન્ટ)ની પાઠ્યક્રમની સમસ્યા નથી. આ માટે શિક્ષણમાં ભારતીયતા આ વિષય મૂળરૂપથી અભ્યાસની પદ્ધતિ (લર્નિંગ મેથોડોલોજી)નો વિષય છે. તે અભ્યાસની પદ્ધતિ ગુરુકુળોમાં આજે પણ અમે પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ વાસ્તવમાં શિક્ષણમાં ભારતીયતા ત્યારે આવશે જ્યારે તે શિક્ષણ પદ્ધતિ આપણા દેંક વિદ્યાલય, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલયમાં કામમાં લેવાશે. ત્યારે શિક્ષક ખરા અર્થમાં વિદ્યાર્થીના આત્માના ઊંડાણ સુધી પહોંચશે અને તેની સાથે ગાઢ સ્થાપિત કરશે. કેમકે પદ્ધતિ (મેથોડોલોજી) તે જ હશે. કારણ કે એકલબ્ય જેવી સ્વયં શિક્ષણ લેવાવાળી પદ્ધતિનો વિકાસ કરી શકશે. ત્યારે પ્રત્યેક વિદ્યાર્થી શિક્ષિત થશે. આ કાર્ય કરવાની જવાબદારી ફક્ત શિક્ષકની છે. શિક્ષક જ આ કરી શકે છે.

આર.ટી.ઈ.માં સુધારો એટલા માટે કરવો પડ્યો કેમકે શિક્ષકોને તૈયાર કર્યા વિના મહિષી અરવિંદની વાતને રજૂ કરી દીધી. અશોક ગાંગુલી ચુપીએસ્સીના ચેરમેન હતા.. લખનૌના રહેવાસી અને મહિષી અરવિંદને માનવાવાળા. એમણે પાઠ્યક્રમ (સિલેબસ)માં પરિવર્તન કર્તી વખતે મહિષી અરવિંદની

નેક વાતો લાવ્યા. મેં તેમની સાથે ચર્ચા કરી. તે વાત લઈને આવ્યા પણ તે સારી વાત પણ નકારવામાં આવી. કેમકે શિક્ષક તેના લીધે તૈયાર નહોતા. જે શિક્ષક તૈયાર થાય તો જ શિક્ષણમાં પરિવર્તન શક્તિ છે. એ માટે સમાજ, રાષ્ટ્ર શિક્ષણ પરિવર્તનની બધી જવાબદારી કોઈની ઉપર છે તો તે શિક્ષક છે. ભારતીય શિક્ષણ મંડળ આ કાર્ય કરી રહ્યું છે. અમે શિક્ષણ માટે એક ‘આનંદશાળા’નું સર્જન કર્યું આમ, તો એને કાર્યશાળા કહે છે અંગેજુમાં વર્ક્ષોપ કહેવાય છે. અમે કીધું કાર્યશાળા નહિ, આનંદશાળા. જેમાં આનંદ આવે એવી આનંદશાળાઓનો વિકાસ કર્યો. અને કહ્યું કે તાતીમ આપનારા અમે કોણ ? શિક્ષકને કોણ તાતીમ આપી શકે ? એટલે તાતીમ કાર્યશાળા નથી. તાતીમ આનંદશાળાને નામ અપાયું. શિક્ષક સ્વાધ્યાય. શિક્ષક પોતાની જતને સુધારશે, શિક્ષક પોતાની અંદર સંસ્કારિતા લાવશે. તે શિક્ષકથી ગુરુ સુધીની સફર કરશે તો જ ભારતીય શિક્ષણનું સપનું ફરી સાચા અર્થમાં સાકાર થઈ શક્શે.

આજથી પરિવર્તન શરૂ થયું છે. વાસ્તવિકતા-માં આજથી દસ વર્ષ પહેલા કોઈ કહેતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હશે, સાઉદી અરેબિયામાં બુરખો પહેરેલ માતાઓ ઓમકારનો નાદ કરી સૂર્યનમસ્કાર કરશે, આવું કોઈ ૨૦૦૭ માં કહેતું તો લોકો કહેતા કે આવું થઈ જ ના શકે. ફક્ત ૧૦ વર્ષમાં સમગ્ર વિશ્વયે યોગનો સ્વીકાર કર્યો અને ૧૯૭ દેશોએ ૨૧ જૂન ૨૦૧૫એ એક સાથે યોગ કર્યો. તેનાથી ભારત માતાનો ૪૪ાંગુરુ બનવાનો માર્ગ ફરીથી શરૂ થયો.

હું છેલ્લા ૨૭ વર્ષથી ભારતના યુવાનો અને શિક્ષકો સાથે કાર્ય કરી રહ્યો છું અને એ અનુભવના આધારે કહું છું કે દેશમાં બદ્દલાવ શરૂ થઈ ગયો છે. એક દાયક પહેલાના પોખરણના ૧૯૬૮ના પરમાણુ પરીક્ષણ પછીથી આ દેશના યુવાનોનો આત્મવિશ્વાસ બદ્દલાયો છે. આજથી દસ વર્ષ પહેલાનો યુવાન વિચારતો હતો કે જે પણ સારું થશે એ વિદેશમાં થશે, ત્યાંથી આપણે લેવું પડશો. સારી ટેકનોલોજી (બેસ્ટ

ટેકનોલોજી) વિદેશમાં હશે. ત્યાંથી આપણે લાવવી પડશો. આજે પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજમાં ભાષનાર વિદ્યાર્થી પણ વિચારે છે કે જે દુનિયામાં થઈ શક્તિ હોય તે ભારતમાં કેમ ના થઈ શકે. આ યુવાનોની આદર્શ માનસિકતા છે. એટલે જ વિજયની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાતા પુનરુત્થાનના માર્ગ પર ચાતી નીકળ્યા છે. જે સમયે યુગ પરિવર્તનનો સમય આવે છે. એ સમયે વધારે બલિદાન માંગે છે અને વધારે ત્યાગની અપેક્ષા હોય છે. ત્યારે એ ગ્રન્થ થશે કે તે સમયે આપણે શું કરીશું ? અમે અમારા દાદાને, અમારા વડીલોને ગ્રન્થ પૂછ્યા હતા કે જે સમયે સુભાષચંદ્ર બોઝ આજાદ હિન્દ સેનાની સ્થાપના કરી રહ્યા હતા, જે સમયે મહાત્મા ગાંધી ‘અંગેલો ભારત છોડો’નો નારો આપી રહ્યા હતા. તે સમયે તમે શું કરી રહ્યા હતા ? એ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં તમારું શું યોગદાન છે ?

આજે બહલાયેલી પરિસ્થિતિમાં ફરી યુગ પરિવર્તન આવ્યું છે. ઈ.સ.૨૦૦૮ થી ૨૦૧૧ સુધી વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફિલ્મિનેશનના સચિવના રૂપમાં અજિત ડોભાલજીની સાથે કામ કરવાનો મને અવસર મળ્યો, જે વર્તમાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. એ વખતે તેઓ અમારા ડાયરેક્ટર હતા. તે જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની વાત કરતા હતા. ત્યારે એક શબ્દનો પ્રયોગ ઘડીએ-ઘડીએ કરતા હતા. એમનો શબ્દ હતો: ‘વિન્ડો ઓફ ઓપર્યુનિટી’ અર્થાત ‘તકની બારી’ ખૂલ્લી છે આજે ભારતને માટે. આજે સમગ્ર વિશ્વ ચાહે છે કે ભારત વિશ્વનું નેતૃત્વ કરે. પછી પર્યાવરણના ક્ષેત્રમાં હોય કે શિક્ષણના ક્ષેત્રમાં, આખી દુનિયા ભારતની તરફ જોઈ રહી છે. કેમકે ભારત ના હોય તો બીજો વિકલ્પ જે એમની સામે છે કે ભયાનક છે. એની વિસ્તારવાદી નીતિથી એ ડરી ગયા છે. એટલા માટે તે ભારતના કલ્યાણકારી નેતૃત્વનો સ્વીકાર કરવા ચાહે છે. કલ્યાણકારી નેતૃત્વ (Benevolent Leadership) ની અપેક્ષા રાજે છે ભારત પાસે. આવા સમયે શિક્ષકની જવાબદારી

મોટી થઈ જય છે. આ ભારતમાં ભારત કેન્દ્રિત, ભારતીય મૂલ્યો પર આધારિત, ભારતીય જીવનદિનને પ્રતિબંધિત કરે ભારતની સંસ્કૃતિમાં જેનું સ્થાન છે એવી શિક્ષણ પદ્ધતિની પુનઃસ્થાપના કરીશું, ત્યારે સાચા અર્થમાં ભારત વિશ્વની આ અપેક્ષાઓને પૂર્ણ કરી શકશે. અથવાંદ્રમાં કહેવાયું છે કે ‘ભદ્રની કામના કરવાવાળા ઋષિઓએ આ રાજ્યના લીધે તપ કર્યું ત્યારે આ રાજ્યનો જન્મ થયો છે. આ ભારતના જન્મનો ઉદ્દેશ્ય છે. વિશ્વના કલ્યાણની કામના કરવાવાળા ઋષિઓની તપસ્યાથી ઊભરી આવેલ આ રાજ્ય છે. એટલે જ્યાં સુધી વિશ્વનું કલ્યાણ ના થાય ત્યાં સુધી આ રાજ્યનું જીવનકાર્ય, જીવન ધ્યેય પૂર્ણ નહીં થાય અને આવું કરવા માટેની પેઢીને તૈયાર કરવાનું કાર્ય શિક્ષકનું છે, ગુરુનું છે.’

આવો, આજના આ પરિસંવાહના પ્રસંગ પર આપણે મનમાં સંકલ્પ લઈએ બલિદાન આપવાનો, સમય આપવાનો, આવા કર્યોના લીધે વધુમાં ફૂંકે ને ભૂસકે આપણે ચોવીસ કલાક આચાર્યત્વ (શિક્ષકત્વ)-ને જાગૃત કરવામાં આવા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો. આવા સંકલ્પ જો શિક્ષક લેશે, તો આપણા પૂર્વજોના સ્વભન નિશ્ચિત રૂપથી સાકાર થશે. આ વિશ્વાસને વ્યક્ત કરતાં હું મારી વાણીને વિરામ આપું છું. જ્ય હિન્દ, જ્યભારત.

અનુસ્નાતક ગુજરાતી વિભાગ
સરદાર પટેલ યુનિવર્સિટી,
વદ્ધા વિદ્યાનગર (મો) ૯૪૨૯૪૧૫૩૬૧

॥ વિદ્યાવૃત્ત ॥

ચારુતર વિદ્યામંડળ સંચાલિત સીકાર્ટનાં પ્રતિનિધિઓએ ‘કેમએક્સ્પો ઇન્ડિયા-૨૦૨૪’ મેગા ઇવેન્ટમાં ભાગ લીધો

દેશ-વિદેશમાં સ્થિત કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટેનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેગાઇવેન્ટ ‘કેમએક્સ્પો ઇન્ડિયા-૨૦૨૪’ તાજેતરમાં તા.૨૪ અને ૨૫ એપ્રિલ, ૨૦૨૪ દરમ્યાન નેશનલ એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે યોજયો હતો. આ એક્ઝિબિશનમાં ભારત તેમજ અન્ય દેશોમાંની સેકડો નાની-મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ પ્રદાતાઓએ ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં ચારુતર વિદ્યામંડળ સંચાલિત અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ડિયા અનુદાનિત સીકાર્ટ સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીયકક્ષાની અનન્યબીઅલની માન્યતા પ્રાપ્ત કરેલ સીકાર્ટ સંસ્થા કેમિકલ અને ફર્મા ટેસ્ટિંગનાં અત્યાધુનિક ઉપકરણો ધરાવે છે, જેનો ઉપયોગ સમગ્ર ભારત દેશનાં સંરોધકો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ તેમજ ઉદ્યોગજગત મોટા પાયે કરે છે. આ એક્ઝિબિશનમાં સીકાર્ટના અનુભવી અને નિપુણ પ્રતિનિધિઓએ વિવિધ કેમિકલ જગતના ઉદ્યોગ સાહસિકોને સંસ્થામાં ઉપલબ્ધ તમામ અત્યાધુનિક સંસાધનોથી માહિતગાર કર્યા હતા. વધુમાં, રાજ્ય તેમજ દેશના સેકડો ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ સીકાર્ટ સંસ્થાના સ્ટોલની મુલાકાત લઈને સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી સંરોધકીય અને ટેસ્ટિંગ સેવાઓ વિશે જાણકારી મેળવી હતી. આ બદલ સીવીઅન્મા ચેરમેન એન્જિનીઝર શ્રી ભીખુભાઈ પટેલ અને સીકાર્ટના ડાયરેક્ટર શ્રી આર.એચ.પરીઅને સમગ્ર સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.

॥ આયુર્વેદ ॥

આધુનિક યુગમાં નિદ્રા

આશિષ એમ. ભડાણીયા¹

રિતેશ ગુજરાથી²

આધુનિક યુગમાં બધા જ લોકો બીમારી પ્રત્યે ખૂબ જ જાગરૂક જોવા મળે છે અને જો કંઈ પણ શરીરમાં અલગ લાગે તો તરત જ કોઈ ડોક્ટરને બતાવી અને તેનું નિરકરણ લાવે છે પણ આ રોજિંદા જીવનમાં શરીર માટેની ખૂબ જ જરૂરી એવી ક્રિયા એટલે કે ઊંઘ પર ધ્યાન આપતા હોતા નથી. આયુર્વેદ પ્રમાણે જોઈએ તો ત્રણ ઉપસ્તંભમાંથી એક નિદ્રાને ગાળવામાં આવી છે. જે આજના યુવાનો કે બાળકોને ખૂબ જ સામાન્ય લાગતી એવી બાબત છે, પણ આપણા શરીર માટે કેટલી જરૂરી અને જો ન લેવામાં આવે તો કેટલી ધ્યાતક સાબિત થઈ શકે છે તેના વિશે વાત કરીએ.

પ્રસ્તાવના :

નિદ્રા એટલે કે તમારી તમામ ઈન્દ્રિયોને તમારા મનથી અલગ કરી અને એક આરામની અવર્થા. જો આપણે જોવા જરૂરી એવી કોઈપણ, વાહન, ઠિલેક્ટ્રિક સાધન બધી જ વસ્તુઓને અમુક સમય માટે બંધ કરવામાં આવે છે, જેથી તે તેની કાર્ય કરવાની શક્તિ જાળવી રાખે. તે રીતે આપણું શરીર પણ ઘણી બધી અલગ-અલગ પ્રણાલીઓની બનેલી રચના છે, જેનું સંતુલન જાળવવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે. જો આયુર્વેદ પ્રમાણે જોઈએ તો નિદ્રા એ એક અધારણીય વેગ છે જેને રોકવાથી શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. અને આધુનિક પ્રણાલી મુજબ WHOની આપેલી માહિતી પ્રમાણે એક તંદુરસ્ત જીવન જીવવા માટે દરરોજ સાત-અઠ કલાકની ઊંઘ જરૂરી છે, પણ હુલના યુવાનો ઘણી બધી કુટેવો, કોઈ વ્યસન, માનસિક તાણના લીધે તથા અન્ય કારણોસર તે પૂર્તી ઊંઘ

લેતા નથી અને આ ઊંઘ ન લેવાની બાબત આગળ જઈને ઘણા બધા માનસિક અને શારીરિક વ્યાધિઓનું કારણ બને છે.

ઊંઘને અસર કરતાં પરિબળો

- * મોડી સુધી રાતે મોબાઇલ અથવા કોઈપણ જ્લૂ લાઈટના સંપર્કમાં રહેવું.
- * દિવસે સૂર્ય જવું.
- * સૂતા પહેલાની થોડીક કલાકો પહેલા જ આહાર લેવો.
- * દિવસમાં કામ અથવા ભાણવાની બાબતની કોઈ ચિંતા.
- * આહારની અંદર દરરોજ વધારે પડતા રુક્ષ ખોરાકનું સેવન કરવું.
- * કોઈ લાંબા સમય માટે ઉપવાસ.
- * કોઈ બીમારીના દુખાવાના કારણો.
- * ચિંતા, કોધ, કોઈ વાતનો ભય વગેરે પરિબળો.

આજ કાલના દોડભાગવાળા જીવનમાં ઘણી બધી વસ્તુઓ જેવી કે રુક્ષ ખોરાક અને હુલના યુવાનો કે બાળકોમાં મોડી રાત સુધી મોબાઇલ વાપરવાની ટેવ ખૂબ જ સામાન્ય બનતી જાય છે. ઘણી બધી વ્યક્તિઓ દિવસ દરમિયાન પણ ઊંઘ લેતા હોય છે પણ આયુર્વેદમાં ગ્રીઝ ઋતુ સિવાય એક પણ ઋતુમાં બપોરે ઊંઘ લેવાની મનાઈ કરવામાં આવી છે કારણ કે ઊંઘમાં સ્નેહ ગુણ હોય છે, જે કફમાં વધારો કરે છે અને પાચક અધિને મંદ કરી નાખે છે અને આગળ જરૂર બીજી બીમારીઓ જેવી કે કમળો, માથામાં દુખાવો, શરદી, ગળાના રોગો, શરીર દુખવું, ખંખવાળ, કક્ષ, તાવ, વગેરે જેવી બીમારીઓમાં પરિણામે છે.

પૂર્તી ઊંઘ ન લેવાથી થતાં નુકસાન

- * આખો દિવસ માથું ભારેભારે લાગવું.
- * શારીરિક બળમાં ઘટાડો થવો.
- * પૂરા દિવસ થાક અનુભવવો.
- * બગાસાં આવવાં.

- * શુકાણુઓનો નાશ થવો.
- * અત્યારના મોડર્ન રોગો જેવા કે એન્ક્જાયટી, ડિપ્રેશનના શિક્ષાર બનવું.
- * આહારનું પૂરતું પાચન ન થવું અથવા તો કબજિયાત જેવું લાગવું.
- * સ્વભાવમાં ચીડિયાપળું આવવું.
- * યાદશક્તિમાં ઘટાડો થવો.
- * આંખોની બીમારીઓ.
- * વજનમાં વધારો થવો.

ઓજ એટલે કે જે આપણી શરીરની રોગો સામે લડવાની રોગપ્રતિકારકશક્તિ અને બળ સાથે જોડાયેલું હોય છે તેના પર પણ ઊંઘથી અસર જોવા મળે છે. સુખ, દુઃખ, મનની પુષ્ટિ, બળ, વીર્યનો વધારો, માનસિક શાંતિ, પેટની પાચન શક્તિ, જ્ઞાન અને આરોગ્ય એ બધું જ આપણી ઊંઘ ઉપર આધાર રાખે છે. પરંતુ અમુક બાબતોમાં વ્યક્તિઓ જેવી કે જે આપો દિવસ ભારે વજન ઊંઘકતી હોય, લાંબી પગપાળા યાત્રા કરેલી હોય, કોઈ શોકમાં, ભયમાં, ગુસ્સામાં, જે અપચાને લગતી બીમારીઓ, વધુ પડતું મહિનાપાન કરેલા, અભ્યાસ, અને ખૂબ જ થાકેલા, બાળકો અને વૃદ્ધોને દિવસ દરમિયાન ઊંઘ લેવાનું સૂચવવામાં આવેલું છે.

ઊંઘ માટેની ચિકિત્સા :

અત્યારે જો અનિદ્રાની ચિકિત્સાની વાત કરીએ તો અમુક એલોપેથિક ગોળીઓ સૂચવવામાં આવે છે, જેનાથી ઊંઘ તો આવે છે પણ આગળ જઈ આ ટેવ અથવા તો કોઈ બીજા શરીરને નુકસાન કરતા પરિબળો બને છે, પણ આપને જો આયુર્વેદ પ્રમાણે આપેલા ચાર પ્રકારના નાના-નાના મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીએ તો એક તંદુરસ્ત ઊંઘ તરફ આપણા

- શરીરને વળી શકીએ છીએ. આયુર્વેદ પ્રમાણે અનિદ્રા જેવી બાબતોની ચિકિત્સા માટે ચાર પ્રકારની પદ્ધતિઓ જેવી કે બાહ્યઉપચાર, માનસિક ઉપચાર, આહારીય ઉપચાર અને અન્ય ઉપચાર આપવામાં આવેલી છે.
- * અભ્યંગ એટલે કે પૂરેપૂરા શરીર પર માલિશ કરવું.
- * આંખોમાં તર્પણ કરવું.
- * સવારે પ્રાણાયામ અને યોગ કરવા.
- * સ્નાન, શિરોલેપ, કર્ષાપૂરણ, શિરોભસ્તી, શિરોધારા જેવી આયુર્વેદિક ચિકિત્સા પ્રણાલી.
- * માથામાં તેલથી માલિશ.
- * ખોરાકની અંદર અનુપ માંસ કે પછી લેંસનું દૂધ પણ ખૂબ જ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- * દિવસે સૂવાની ટેવ બંધ કરવી
- * ધૂમ્રપાનની આદત છોડવી.
- * દરરોજ એક સમય પ્રમાણે કાયમી સૂવું.

ધારી વાર અમુક લોકો એવો પણ દાવો કરતાં હોય છે કે અમે પાંચ કલાક ઊંઘીને પણ અમારી નિદ્રા પૂરી થઈ જાય છે. પરંતુ અહીં આ સમજવા જેવું છે કે બધા લોકોના શરીર, વ્યવસાય, માનસિક ક્ષમતા અલગ હોય છે માટે દરેક વ્યક્તિ અને ઉંમરના લોકો માટે અલગ અલગ કલાકોની ઊંઘનું વર્ઝન કરવામાં આવેલું છે. આમ, આપણે આધુનિક જીવનશૈલીમાં તમામ માનસિક અને શારીરિક રોગો સામે ઉપર જાગાવેલ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણા જીવનમાં અપનાવીએ અને એક તંદુરસ્ત ઊંઘથી સ્વસ્થ શરીરની રૂચના કરીએ.

પ્રથમ વર્ષ, બી.એ.એમ.એસ.¹
વિભાગાધ્યક્ષ, સંહિતા સિદ્ધાંત અને સંસ્કૃત²
જી. જી. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદિક સ્ટડીज
એન્ડ રિસર્ચ, ન્યૂ વલ્સબિલિયાનગર

ધ્યાન એ નિદ્રાનો વિકલ્પ નથી. નિદ્રા અને ધ્યાન બંનેના પોતાના ફાયદા છે.
જો નિયમિત કરવામાં આવે છે તો ધ્યાન તમારી નિદ્રાની ગુણવત્તા સુધારી શકે છે

આકૃતર વિદ્યાર્થી અંશાલિત શરૂઆતોનાં પરિણામ

Secondary & Higher Secondary Schools Board Exam Result : March-2024

Sr. No.	Name of School	Appeared in Exam	Pass	Fail	Grade					Total Pass	School Result %	Board Result %		
					A1	A2	B1	B2	C1	C2	D			
Secondary Section														
1.	V & C Patel English School (CBSE)	116	116	00	13	29	33	21	16	03	01	116	100	93
2.	I. B. Patel English School (SF)	83	82	01	09	30	18	14	08	03	00	82	98.79	82.56
3.	I. B. Patel English School (GIA)	229	223	06	16	58	53	55	28	13	00	223	97.37	82.56
4.	G. J. Sharda Mandir	237	209	28	07	38	41	47	61	14	01	209	88.19	82.56
5.	M.U.Patel Technical High School	157	107	50	03	07	27	19	27	22	02	107	68.15	82.56
6.	S.D.Desai High School	63	41	22	00	02	07	11	14	07	00	41	65.07	82.56
Total		885	778	107	48	164	179	167	154	62	04	778	87.91	
Higher Secondary Section														
1.	V & C Patel English School (CBSE)	90	90	00	12	19	21	32	06	00	09	90	100	87.98
2.	C.V.M.Higher Secondary Education Complex-Vocation Stream (Home Secience)	60	54	03	00	10	17	15	06	03	03	54	90.00	89.34
3.	C.V.M.Higher Secondary Education Complex-General Stream (TVPatel)	387	363	24	03	38	69	104	96	50	03	363	93.80	91.92
4.	I.B.Patel English School (SF)	14	12	02	01	01	04	03	02	00	12	85.71	82.45	
5.	C.V.M.Higher Secondary Education Complex-Science Stream (RPTP)	554	473	81	06	50	111	108	96	91	11	473	85.38	82.45
Total		1105	992	110	22	118	219	263	207	146	17	992	89.77	--

Overall Grand Total : 1770 / 1990 = 88.94%

V-Vidyanagar 26 (6)
Published on 05/06/2024
No. of Pages 36 Including Cover
ISSN 0976 – 9609 V-Vidyanagar

BOOK POST
June 2024

Postal Regd. No. AND/318/2024-26
RNI Regd. No. Guj/2009-11/5433
Posted at Vallabh Vidyanagar on
5th of Every Month



ઉપપ્રમુખશ્રી મનીષભાઈ પટેલ, માનદ્દ મંત્રીશ્રી ડૉ. એસ. જી. પટેલ, માનદ્દ સહમંત્રીશ્રી વિશાળભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીની ઘટક સંસ્થાઓના આચાર્યશ્રીઓ, નિયામકશ્રીઓ તથા શિક્ષકગણ દશમાન થાય છે.

ધોરણ ૧૨ ની વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના કારડિટી માર્ગદર્શન હેતુ ચારુતર વિદ્યામંડળ તથા ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા તા. ૧૬, ૧૭ અને ૧૮ મે ૨૦૨૪ ના રોજ વી. એન્ડ સી પટેલ, એંજિઝ સ્કૂલ ખાતે એન્સ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એન્સ્યુકેશન ફેરમાં ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમોને અનુલક્ષીને વિષય તજ્જ્ઞો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને તેમની ભવિષ્યતીની કારડિટીને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ એન્સ્યુકેશન ફેરના ચરોતર પંથકના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વલ્લબ વિદ્યાનગરના નગરજનોએ બહોળી સંજ્યામાં લાભ લીધો હતો. તસવીરોમાં એન્સ્યુકેશન ફેરનું ઉદ્ઘાટન કરતા સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખશ્રી એન્ઝિ. ભીજુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. દર્શક દેસાઈ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની ઘટક સંસ્થાઓના આચાર્યશ્રીઓ, નિયામકશ્રીઓ તથા શિક્ષકગણ દશમાન થાય છે.

Editor : Dr. Urvish Chhaya

If undelivered, return to

Dr. S.G. Patel, Hon. Secretary, Charutar Vidya Mandal,
Vallabh Vidyanagar 388120, Gujarat (INDIA)

(Printed, Published and Owned by Charutar Vidya Mandal, Vallabh Vidyanagar)